



બેંકની રજીસ્ટર્ડ ઓફીસ

" નવાનગર બેંક ભવન ", હિરજી મીસ્ત્રી રોડ, પ્રજ્ઞામી સ્કૂલ સામે , જામનગર

ફોન નંબર:- ૦૨૮૮-૨૫૬૩૯૮૪-૮૫-૮૮-૮૯-૯૦-૯૩, ફેક્સ નંબર:- ૦૨૮૮-૨૫૬૩૯૮૯

E-mail : ho@nawanagarbank.co.in, Website : www.nawanagarbank.co.in

તા. ૩૧-૦૩-૨૦૧૯ ની સ્થિતિએ	માનનીયશ્રી,	
શેર ભંડોળ રૂ. ૧૬.૦૬ કરોડ	ઘી નવાનગર કો-ઓપરેટીવ બેંક લી. નો તા. ૩૧-૦૩-૨૦૧૯ના રોજ પુરા થતા વર્ષનો ૪૧મો વાર્ષિક અહેવાલ આપને મોકલતા આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ.	
રિઝર્વ ફંડ અને અન્ય રિઝર્વ રૂ. ૧૨૫.૧૨ કરોડ	બેંકના વ્યવહારમાં પારદર્શિતાના ધોરણો અપનાવી બેંકે વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરેલ છે. બેંક હાલ ગ્રાહકોને મહત્તમ બેંકીંગ સેવાઓ ફ્રી ઓફ ચાર્જ પુરી પાડી રહેલ છે. બેંક અંગેની માહિતી રજુ કરવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. ચાલુ વર્ષની બેંકની કામગીરી ઓલટાઈમ હાઈ છે. બેંકે રૂ. એક હજાર કરોડના બિઝનેસને પાર કરેલ છે જે માટે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. બેંકની આ વિકાસયાત્રા હજુ પણ વિશેષ પ્રગતી કરે તે માટે કર્તવ્ય પરાયણ છીએ. જે માટે આપના સુચનો અમારા માટે માર્ગદર્શક તથા ઉપયોગી રહેશે.	
ડિપોઝીટ રૂ. ૬૬૮.૯૮ કરોડ	બેંકની આ વણથંભી વિકાસ યાત્રા માં આપ સર્વે સભાસદશ્રીઓની શુભેચ્છા તથા બેંકના ખાતેદારો / ગ્રાહકોનો અતુટ વિશ્વાસ તેમજ સ્ટાફની ઉત્તમ ગ્રાહક સેવાને આભારી છે.	
ધિરાણો રૂ. ૩૬૨.૨૧ કરોડ	આપના સહકારી	
કાર્યકારી નફો રૂ. ૧૮.૭૮ કરોડ	શ્રી કિરણભાઈ આર. માધવાણી ચેરમેન	શ્રી રમણિકલાલ કે. શાહ મેનેજીંગ ડાયરેક્ટર
ચોખ્ખો નફો રૂ. ૯.૯૧ કરોડ		
શાખાઓ ૧૧ શાખા તથા ૧ એક્સ્ટેન્શન સેન્ટર		
ઓડીટ વર્ગ A	શ્રી નાથાલાલ વી. મુંગરા વાઈસ ચેરમેન	શ્રી હિતેશભાઈ જી. પરમાર જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર



Registration No. & Date	Reserve Bank Licence & Date	Starting Date of Business
C-1907 Dt. : 17-07-1978	ACD-GJ-196-P Dt. : 02-04-1980	Dt. : 28-08-1980
PAN	TAN	GSTIN
AAAAT2422Q	RKTT01135B	24AAAAT2422Q1ZE

IFSC CODE	IBKL0427NCB
OSS CODE	08660701
DICGC CODE	42973
P. F. CODE	GJRAJ0016903000
DEAF CODE	705
WORKING AREA	JAMNAGAR, DEV BHUMI DWARIKA & RAJKOT DISTRICT

Sr. No.	Branches	RBI Licence		Branch Starting Date	Bank Code	MICR Code Numeric
		Number	Date			
1	Digvijay Plot	UBD.AH/764	01/07/2011	28/08/1980	621	001
2	Udyognagar	UBD.AH/9	12/08/1992	22/10/1993	621	002
3	Hospital Rd.	UBD.AH/68	26/07/1994	11/12/1995	621	003
4	Saru Section	UBD.AH/67	26/07/1994	28/03/1995	621	004
5	Ranjit Rd.	UBD.AH/324	26/03/1997	16/03/1998	621	005
6	Gulabnagar	UBD.AH/501	05/01/2000	17/03/2001	621	006
7	Dared	UBD.AH/675	13/12/2007	12/05/2008	621	007
8	Khambhalia Rd.	UBD.AH/717	10/06/2009	28/08/2009	621	008
9	Ranjit Sagar Rd.	UBD.AH/864	19/05/2014	30/06/2014	621	009
10	Gokulnagar	UBD.AH/937	24/09/2015	19/11/2015	621	010
11	Pancheswar Tower	UBD.AH/1039	24/10/2017	22/01/2018	621	011
12	Haria Ex. Counter	UBD.AH/6154	18/03/2010	01/06/2010	621	



વાર્ષિક સામાન્ય સભાની નોટીસ

આથી ધી નવાનગર કો-ઓપરેટીવ બેંક લી., જામનગરના તમામ સભાસદોને જાણ કરવામાં આવે છે કે, આ બેંકની ૪૧મી વાર્ષિક સામાન્ય સભા તા. ૨૭/૦૭/૨૦૧૯ ને શનિવારના રોજ સાંજે ૧૬ : ૦૦ કલાકે શ્રી કુંવરબાઈ જૈન ધર્મશાળા, ન્યુ જેલ રોડ, પવનચક્કી પાસે, જામનગરમાં નીચે દર્શાવેલ કામગીરી માટે મળશે. આથી સર્વે સભાસદોને સમયસર હાજરી આપવા વિનંતી.

કાર્યસૂચિ (એજન્ડા)

૧. તા. ૨૮/૦૭/૨૦૧૮ના રોજ યોજાયેલ વાર્ષિક સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલ રાખવા બાબત.
૨. બેંકના પેટાનિયમોમાં સુધારાઓ મંજૂર કરવા બાબત.
૩. તા. ૩૧.૩.૨૦૧૯ના રોજ પુરા થયેલ વર્ષના ઓડીટ થયેલા હિશાબો તથા ઓડીટર્સ રીપોર્ટ મંજૂર કરવા તથા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તરફથી ૨૦૧૮-૧૯ના વર્ષનો રજૂ થયેલ કામકાજ અહેવાલ મંજૂર કરવા.
૪. સને ૨૦૧૮-૧૯ના વર્ષના ચોખ્ખા નફાની રકમ રૂ. ૯,૯૦,૫૮,૯૧૩.૪૫ પૈ. ની ફાળવણી મંજૂર કરવા બાબત.
૫. સને ૨૦૧૮-૧૯ના વર્ષની સભાસદ ભેટ આપવા વિચારણા કરવા બાબત.
૬. નબળાં ધિરાણ ખાતાઓની પતાવટથી થયેલ વસુલાતને બહાલી આપવા બાબત.
૭. ચેરમેનશ્રી તરફથી અગર તેમની મંજૂરીથી બેંકના હિતમાં રજૂ થાય તે પર વિચારણા કરી યોગ્ય કરવા.

જામનગર

તા. ૧૨/૦૭/૨૦૧૯

આર. કે. શાહ

મેનેજીંગ ડાયરેક્ટર

નોંધ

૧. નફા નુકશાન ખાતું તથા સરવૈયાની નકલ સભાસદને જોઈતી હોય તો બેંકની કોઈપણ શાખા પરથી મેળવી શકશે.
૨. સભાસદોની યાદી તેમજ ક્રમાંક વગેરે જો જોવાના હોય તો બેંકની હિરજી મીસ્ટ્રી રોડ પર પ્રણામી સ્કુલ સામે આવેલ બેંકની રજીસ્ટર્ડ ઓફીસ ખાતે જોઈ શકાશે.
૩. ગત વાર્ષિક સામાન્ય સભાની કાર્યવાહી નોંધ આ સાથે સામેલ છે.
૪. સભા મળવાના સમયથી અડધા કલાક સુધીમાં કોરમ નહિં થાય તો સભા અડધો કલાક મુલત્વી રાખવામાં આવશે અને સાંજના ૧૬-૩૦ વાગ્યે તે જ સ્થળે ફરીથી મળશે જેમાં કોરમનો બાદ રહેશે નહીં.
૫. જો સભાસદશ્રીઓને વાર્ષિક સામાન્ય સભામાં કોઈ પ્રશ્ન પુછવાના હોય તો બેંકને અઠવાડીયા પહેલા લેખિત જણાવવું જેથી વહીવટી ખુલાસા કરવામાં સરળતા રહે.



માનનીય સભાસદશ્રીઓ,

આપણી બેંકની ૪૧મી વાર્ષિક સામાન્ય સભામાં આપ સર્વને આવકારતા આનંદની લાગણી અનુભવું છું. આપણી બેંક પ્રગતીના નવા નવા સોપાનો સર કરી રહી છે. આપણી બેંકે તેની લાંબી અને યશસ્વી કામગીરીના ૪૧ વર્ષ પુરા કરેલ છે. હાલ આપણી બેંક ૧૧ શાખા અને ૧ એક્સટેન્શન કાઉન્ટર સાથે જામનગર શહેરની જનતાને આધુનિક બેંકીંગની ઉત્તમ કસ્ટમર સેવાઓ આપી રહેલ છે. ધિરાણ પણ પ્રમાણમાં હળવા વ્યાજ અને સરળ પ્રોસીજરથી આપી રહેલ છે. પરિણામ સ્વરૂપ સને ૨૦૧૮-૧૯ના વર્ષમાં થાપણમાં ગત વર્ષ કરતા રૂ. ૪૦.૩૮ કરોડનો વધારો થતા બેંકની થાપણો વધી રૂ. ૬૬૮.૮૮ કરોડ પર પહોંચેલ છે. આજ રીતે ધિરાણમાં રૂ. ૬૫.૬૩ કરોડની વૃદ્ધિ થતા ધિરાણો વધી રૂ. ૩૬૨.૨૧ કરોડ પર પહોંચેલ છે. બેંકનો કાર્યકારી નફામાં પણ રૂ. ૩.૨૧ કરોડની વૃદ્ધિ થતા ઓલ ટાઈમ હાઈ રૂ. ૧૮.૭૮ કરોડ પર પહોંચેલ છે. બેંકની આ પ્રગતી આપ સર્વ સભાસદોએ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પર મુકેલ અતુટ વિશ્વાસનું પરિણામ છે. બેંકની આ પ્રગતીનો યશ આપ સર્વ સભાસદો, મારા સાથી ડાયરેક્ટર્સ, બેંકના ગ્રાહકો તથા ઉત્તમ ગ્રાહક સેવા આપતા બેંકના સ્ટાફને ફાળે જાય છે.

બેંકની કામગીરીનું મુલ્યાંકન:

૧. નાણાંકિય પરિસ્થિતિ:-

બેંકની નાણાંકિય સ્થિતિ જોતા બેંકની શેર મુડી તથા રિઝર્વમાં રૂ. ૮.૫૦ કરોડનો વધારો થતા રૂ. ૧૪૧.૧૮ કરોડ થયેલ છે. બેંકના રોકાણો રૂ. ૩૮૫.૭૧ કરોડના છે. જેમાં સરકારી જામીનગીરીમાં રોકાણો રૂ. ૩૪૨.૮૮ કરોડ છે એટલે કે ૮૮.૯૦% રોકાણ સરકારી જામીનગીરીમાં કરવામાં આવેલ છે. બેંકના બિઝનેસમાં રૂ. ૧૦૬.૦૧ કરોડનો વધારો થતા ઓલ ટાઈમ હાઈ રૂ. ૧૦૩૧.૧૮ કરોડ થયેલ છે. બેંકનું નેટ એન.પી.એ. ઝીરો યથાવત રહેલ છે.

૨. નફાની ફાળવણી:-

બેંકના પેટા નિયમોની જોગવાઈ મુજબ સને ૨૦૧૮-૧૯ના વર્ષના નેટ પ્રોફીટ રૂ. ૮,૯૦,૫૮,૯૧૩.૪૫ પૈ. ની ફાળવણી નીચે મુજબ કરવા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા ભલામણ કરવામાં આવેલ છે. જેને આપ સર્વ મંજૂરી આપશો તેવી વિનંતી છે.

	રકમ રૂ.	રકમ રૂ.
ચોખ્ખો નફો		૮,૯૦,૫૮,૯૧૩.૪૫
બાદ : (પેટા નિયમ ૫૫(બ) મુજબ ફાળવણી)		
રીઝર્વ ફંડ (ચોખ્ખા નફાના ૨૫%)	૨,૪૭,૬૪,૭૨૮.૪૫	
શેર પર ડિવિડન્ડ (શેર મુડીના ૧૫%)	૨,૧૬,૮૨,૦૦૦.૦૦	
સહકારી શિક્ષણ ફંડ ખાતે (મહત્તમ)	૩,૦૦,૦૦૦.૦૦	
(નફાના ૨.૫% અથવા મહત્તમ મર્યાદા મુજબ બેમાંથી જે ઓછું હોય તે)		
૧૫% ખરાબ લેણાં અનામત (BAD DEBT RESERVES)	૧,૪૮,૫૮,૮૩૭.૦૦	
ઘર્માદા ફંડ (ચોખ્ખા નફાના ૧%)	૮,૯૦,૫૮૯.૦૦	
ઈન્વેસ્ટમેન્ટ રિઝર્વ ફંડ	૫૦,૦૦,૦૦૦.૦૦	
કુલ ફાળવણી (પેટા નિયમ ૫૫(બ) મુજબ)		૬,૭૫,૮૬,૧૫૪.૪૫
પેટા નિયમ ૫૫(બ) ની ફાળવણી બાદ નફો		૩,૧૪,૬૨,૭૫૯.૦૦
બાદ : (પેટા નિયમ ૫૫(ક) મુજબ ફાળવણી)		
૨૫% બિલ્ડીંગ ફંડ ખાતે	૭૮,૬૫,૬૯૦.૦૦	
૧૦% ડિવિડન્ડ ઈકવીલાઈઝેશન ફંડ ખાતે	૩૧,૪૬,૨૭૬.૦૦	
૧૫% સહકારી પ્રચાર ફંડ ખાતે	૪૭,૧૯,૪૧૪.૦૦	
૮% સ્ટાફવેલ્ફેર ફંડ ખાતે	૨૮,૩૧,૬૪૮.૦૦	
૩% કન્ટ્રીજન્સી ફંડ ખાતે	૮,૪૩,૮૮૩.૦૦	
૩૦% સભાસદ કલ્યાણ ફંડ ખાતે	૮૪,૩૮,૮૨૮.૦૦	
૨% શહેરી વિકાસ ફંડ ખાતે	૬,૨૯,૨૫૫.૦૦	
૬% સ્પેશ્યલ રીઝર્વ ફંડ ખાતે	૧૮,૮૭,૭૬૫.૦૦	૩,૧૪,૬૨,૭૫૯.૦૦



૩. ડિવિડન્ડ:-

બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સભાસદોને વર્ષ ૨૦૧૮-૧૯ માટે ૧૫% ડિવિડન્ડ આપવાની ભલામણ કરેલ છે, તે સ્વિકારી મંજૂર કરવા વિનંતી છે.

૪. મુકી પર્યાપ્તતાનો ગુણોત્તર - CRAR :-

બેંકની આર્થિક સધ્ધરતા દર્શાવતો આંક CRAR જે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના માપદંડ મુજબ લઘુત્તમ ૯% હોવો જોઈએ તે ૩૧/૦૩/૨૦૧૯ ના વર્ષ આખરે ૨૨.૭૨% રહેલ છે. જે બેંકની સધ્ધરતા દર્શાવે છે.

૫. ડીપોઝીટ : કુલ થાપણો વધીને રૂ. ૬૬૮.૯૮ કરોડ - ૬.૪૨% નો વધારો :

વર્ષાંતે આપણી બેંકની થાપણો ગત વર્ષની સરખામણીએ ૬.૪૨% ના વધારા સાથે રૂ. ૬૬૮.૯૮ કરોડ સુધી પહોંચેલ છે. તેમજ વર્ષાંતે બેંકની લો-કોસ્ટ ડીપોઝીટ્સ (CASA) રૂ. ૨૯૭.૪૭ કરોડ હતી. જે કુલ ડીપોઝીટના ૪૪.૪૭% છે. મ્યુચ્યુલ ફંડ જેવી નાણાંકીય યોજનાઓમાં રોકાણ વધ્યું હોવા છતાં આપણી બેંકની થાપણોમાં વધારો થયો છે. જે બેંક ઉપર વિશ્વાસ મુકનારા થાપણદારો, સભાસદો અને ગ્રાહકોને આભારી છે. બેંક નાના તેમજ મધ્યમ વર્ગના ખાતેદારોને બચત કરવા માટે પ્રોત્સાહિત કરવા સતત પ્રયત્નશીલ રહેલ છે.

નાણાંકીય સમાવેશિતા માટે આપણી બેંક દ્વારા Basic Saving Bank Deposit Account ખોલી રીઝર્વ બેંકના આદેશનું પાલન કરવામાં આવે છે. આ ઉપરાંત નાના બચતકારો માટે ફેબ્રુઆરી-૨૦૧૯ અને માર્ચ-૨૦૧૯ ના સમયગાળા માટે Special Deposit Scheme અમલમાં લાવી નાના થાપણદારોને રૂ. ૫,૦૦૦/- થી રૂ. ૨૫,૦૦૦/- સુધીની રકમ બાંધી મુદતમાં ૬ મહીનાથી એક વર્ષ ના ગાળામાં મુકનાર ને પ્રીવેલીગ ડીપોઝીટ ઈન્ટરેસ્ટ રેઈટ ના ૦.૫% થી ૧% સુધી વધારે વ્યાજ આપવામાં આવેલ છે. આમ નાના થાપણદારોનો બેંકીંગમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.

૬. સીનીયર સીટીઝન (વરીષ્ઠ નાગરિક) ને ફીક્સ ડીપોઝીટ ઉપર વધુ વ્યાજ :

આપણી બેંક સિનીયર સીટીઝનને છ મહીના કે તેથી વધુ સમય માટેની ફીક્સ ડીપોઝીટ ઉપર પ્રવર્તમાન ડીપોઝીટના વ્યાજ કરતાં હાલમાં ૦.૫૦% વધુ વ્યાજ આપે છે. આ માટે બેંકની ડીપોઝીટમાં સીનીયર સીટીઝનનું નામ પ્રથમ હોવું જરૂરી છે.

૭. ડીપોઝીટનું વીમા કવચ :

બેંકના થાપણદારોની રૂ. ૧.૦૦ લાખ સુધીની થાપણો વિમાથી સુરક્ષિત છે અને તે અંગેનું પ્રિમીયમ નિયમો અનુસાર નિયમિતપણે ચૂકવી આપવામાં આવે છે. બેંકે તા. ૩૦/૦૯/૨૦૧૯ સુધીના છ માસિક પ્રિમીયમની રકમ રૂ. ૩૯,૪૯,૮૫૮/- નિયત મુદત પહેલાં Deposit Insurance & Credit Guarantee Corporation of India - Mumbai ને એડવાન્સમાં મોકલી આપેલ છે. સુધારેલા નિયમ મુજબ જોઈન્ટ નામની ડીપોઝીટ્સ ઓલ્ટરનેટ જોઈન્ટ નામે ગોઠવવાથી આ યોજના હેઠળ વીમાનો મહત્તમ લાભ મળી શકશે.

૮. ધિરાણો : કુલ ધિરાણો વધીને રૂ. ૩૬૨.૨૧ કરોડ - ૨૨.૧૩%નો વધારો

બેંકની નફાકારકતાનો આધાર ગુણવત્તાયુક્ત ધિરાણ પર રહેલો છે. રીઝર્વ બેંકની માર્ગદર્શક સૂચનાઓ તથા થાપણદારોના નાણાંની સલામતી ધ્યાનમાં રાખી ધિરાણ આપવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હંમેશા ખૂબ જ વ્યવહારિક અને સહકારી અભિગમ રાખે છે. બેંકનું વર્ષાંતે ધિરાણ રૂ. ૩૬૨.૨૧ કરોડનું થયેલ છે. જે ગત વર્ષ સામે રૂ. ૬૫.૬૩ કરોડ એટલે કે, ૨૨.૧૩% નો વધારો દર્શાવે છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયત ધોરણો અનુસાર બેંકે તેમની એડજેસ્ટેડ નેટ બેંક કેડીટના ૪૦% જેટલું ધિરાણ પ્રાયોરીટી સેક્ટરમાં તથા તે પૈકી ૧૦% ધિરાણ નબળા વર્ગોને કરવાનું હોય છે. જેના સામે આપણી બેંકે પ્રાયોરીટી સેક્ટરમાં ૪૪.૯૦% તેમજ નબળા વર્ગને ૧૦.૦૮% ધિરાણ કરેલ છે.



૯. રોકાણો : કુલ રોકાણો રૂ. ૩૮૫.૭૧ કરોડ :

રિઝર્વ બેંક તથા સહકાર ખાતાની વખતોવખતની માર્ગદર્શક સુચનાઓને આધીન રહી આપણી બેંક ફાજલ ભંડોળોનું ખૂબજ વ્યવહાર અને નિયમબધ્ધ રોકાણ કરે છે. તે મુજબ તા. ૩૧/૦૩/૨૦૧૯ આખરે બેંકના કુલ રોકાણો રૂ. ૩૮૫.૭૧ કરોડ છે. જે પૈકી ગવર્નમેન્ટ સીક્યુરીટીમાં રૂ. ૩૪૨.૮૮ કરોડ તેમજ અન્ય બેંકોની ફીક્સડ ડીપોઝીટમાં રૂ. ૪૨.૮૩ કરોડ છે. આ રોકાણોના સંભવિત જોખમો સામે રક્ષણ મેળવવા રીઝર્વ બેંકની સુચના મુજબ બેંકે રૂ. ૧૨.૮૧ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ડેપ્રિસીએશન રીઝર્વ તથા રૂ. ૧૪.૪૫ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ફલકચ્યુએશન રિઝર્વ ફંડ ઉભું કરેલ છે. જે બેંકની નાણાંકીય તરલતા અને સધ્ધરતાનો પુરાવો છે.

૧૦. સ્ટેચ્યુટરી ઓડીટ :

મે. હરીક્રિષ્ના ઘાડીયા એન્ડ કું., ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, FRN No. :103534W, રાજકોટ દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ ના હિસાબોનું સ્ટેચ્યુટરી ઓડીટ કરવામાં આવેલ છે અને તેમણે બેંકની પ્રગતિ અને કામગીરી ધ્યાનમાં લઈ ઓડીટ વર્ગ "અ" કાયમ રાખેલ છે.

૧૧. સિદ્ધીઓ :

૧. ગુજરાત અર્બન કો.-ઓપેટીવ બેંકસ ફેડરેશન તરફથી અમદાવાદ ખાતે જુલાઈ-૧૮ ના માસમાં યોજવામાં આવેલ સહકાર સેતુ-૨૦૧૮ ના કાર્યક્રમમાં બેંકને સને ૨૦૧૭-૧૮ ના વર્ષની કામગીરી ના સંદર્ભમાં એફીસયન્સી રેશીયો તથા કાસા ડિપોઝીટ માટે એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. તેમજ બેંકના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી રમણિકલાલ કે. શાહને શહેરી સહકારી બેંકોના ડાયરેક્ટર તરીકેની દિર્ઘકાલીન સેવાઓ બદલ પણ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે.
૨. બેંકની મોબાઈલ એપ માં NEFT થઈ શકે તેમજ ટેલીફોન બીલ - વીજ બીલ જેવા યુટીલીટી પેમેન્ટ થઈ શકે તેવી સુવિધા શરૂ કરેલ છે.

૧૨. ગ્રાહક સેવા :

વર્તમાન સ્પર્ધાત્મક સમયમાં પારદર્શક અને શ્રેષ્ઠ ગ્રાહક સેવા બેંકની પ્રગતિ અને વિશ્વાસનું પ્રતિક છે. ગ્રાહકોની જરૂરીયાત મુજબની બેંકીંગ સેવાઓ પુરી પાડવાનો શક્ય તેટલો પ્રયાસ કરેલ છે. બેંક દ્વારા ગ્રાહક સેવા વધુ સુદૃઢ બનાવવાના હેતુથી નીચે મુજબની વિશેષ સેવાઓ ગ્રાહકોને પ્રદાન કરવામાં આવે છે. આ તમામ સેવાઓ ફ્રી ઓફ ચાર્જ પુરી પાડવામાં આવી રહેલ છે.

- **SMS સુવિધા :** ગ્રાહકના ખાતાના તમામ વ્યવહારોની જાણ તેમના રજીસ્ટર્ડ મોબાઈલ ઉપર SMS દ્વારા કરવામાં આવે છે.
- Electronic fund transfer – RTGS, NEFT તથા NACH સુવિધા.
- ATM - cum - Debit Card (RuPay) : આ સુવિધા અંતર્ગત બેંક દ્વારા તેના ગ્રાહકોને વિના મુલ્યે RuPay ATM - cum - Debit Card આપવામાં આવે છે, જે ભારત ભરમાં તમામ બેંકોના ATM સેન્ટર ખાતે માન્ય છે. ઉપરાંત RuPay Debit Card દ્વારા મોલ, પેટ્રોલ પંપ, દુકાનો જેવા વેચાણ કેન્દ્રો ઉપરથી પોઈન્ટ ઓફ સેલ (POS) દ્વારા ખરીદી કરી શકાય છે. આપણી બેંકના ગ્રાહકો દ્વારા ડેબીટ કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે.
- E-Commerce : - આપણી બેંકના RuPay Debit Card થી ખાતેદાર રેલ્વે/પ્લેનની ટિકીટ, મલ્ટીપ્લેક્સ સિનેમાની ટિકીટ અને પેટ્રોલની ખરીદી, હોટલમાં પેમેન્ટ કરી શકશે તથા ઓનલાઈન ખરીદી પણ કરી શકે છે. હાલમાં ઓનલાઈન ખરીદીનો વ્યાપ વધતો જાય છે.
- Missed call સુવિધા :- બેંકના ગ્રાહકોને બેંકમાં રજીસ્ટર્ડ કરાવેલ મોબાઈલ નંબર દ્વારા "૭૦૬૯૦ ૭૦૯૦૦" નંબર ઉપર મીસડ કોલ કરવાથી SMS દ્વારા પોતાના ખાતાઓનું બેલેન્સ મેળવી શકે છે.
- આપણી બેંકની તમામ શાખાઓમાં ગુજરાત ગેસના બીલ નું પેમેન્ટ સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ છે.



- આપણી તમામ શાખાઓમાં જામનગર મહાનગર પાલીકા ના વેરાઓ ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
- આપણી બેંકની શરૂ સેક્શન, ગુલાબનગર, દરેડ, રણજીત સાગર રોડ અને ગોકુલનગર શાખાઓમાં પી.જી.વી.સી.એલ.ના વિજ બીલ કલેક્શન સેન્ટર પણ શરૂ કરવામાં આવેલ છે.
- આપણી બેંકની હેડ ઓફીસ પર ઈન્કમ ટેક્ષ પેમેન્ટ તથા શાખાઓમાં GST નું NEFT દ્વારા પેમેન્ટની સુવિધાઓ આપવામાં આવે છે.
- બેંક દ્વારા ગ્રાહકોને મોબાઇલ બેંકિંગ સુવિધા મળે તે માટે મોબાઇલ એપ શરૂ કરવામાં આવેલ છે. જેનાથી ગ્રાહકો પોતાના ખાતામાંથી IMPS / NEFT મારફત ફંડ ટ્રાન્સફર, ભારત બિલ પેમેન્ટ સાથે લીંક કરેલ હોય ગુજરાત ગેસ, વિજબીલ, ટેલીફોન બિલ જેવા યુટીલીટી ચાર્જીસ પેમેન્ટ કરી શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવેલ છે.

૧૩. વિશેષ સેવા :

બેંક તરફથી નીચે મુજબની વિશેષ સેવાઓ બેંકના ગ્રાહકોના હિતમાં પુરી પાડવામાં આવી રહેલ છે.

૧. બેંક ભારત સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના નીચે માન્ય બેંક તરીકે કાર્યરત છે. જેથી બેંક દ્વારા અપાતી હાઉસિંગ લોન પૈકી પ્રધાન મંત્રી આવાસ યોજનાની જોગવાઈ મુજબ વ્યાજ સબસીડી મળવાપાત્ર હોય તેવા કિસ્સાઓમાં તેમના લોન ખાતામાં વ્યાજ સબસીડી સીધી જમા થઈ જાય તે રીતે બેંક સતત સેવાઓ આપી રહેલ છે. ચાલુ વર્ષમાં ૧૬ લાભાર્થીઓને રૂ. ૩૯ લાખની વ્યાજ સબસીડી મળેલ છે.
૨. માનનીય પ્રધાનમંત્રીશ્રીની જન સુરક્ષા યોજના નીચે બેંક દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોત બિમા યોજના નીચે ચાલુ વર્ષે ૬ લાભાર્થીનું અવસાન થતા રૂ. ૧૨ લાખનો વિમો ચુકવાયેલ છે.
૩. આ ઉપરાંત સામાજિક સુરક્ષાના ભાગ રૂપ જીવનવિમાની કામગીરી માટે એક્સાઈડ લાઈફ ઈન્સ્યોરન્સ સાથે ટાઈઅપ કરી જીવન વિમાની સેવાઓ પણ પુરી પાડવામાં આવી રહેલ છે. ચાલુ વર્ષ દરમિયાન ૨ વિમેદારનું અવસાન થતા ત્વરિત કલેઈમ મળે તે માટે કાર્યવાહી કરેલ છે અને રૂ. ૨.૮૮ લાખ વિમા કંપની દ્વારા ચુકવાયેલ છે.
૪. બેંક દ્વારા કરવામાં આવતા ધિરાણોમાં લેવામાં આવતી પ્રાયમરી તેમજ કોલેટરોલ સિક્યોરીટીમાં વિમાનું સુરક્ષા કવચ ખાતેદારોને સરળતાથી મળી રહે તે માટે એસ.બી.આઈ. જનરલ ઈન્સ્યોરન્સ સાથે ચાલુ વર્ષમાં ટાઈઅપ કરવામાં આવેલ છે.

૧૪. સભાસદ

બેંક સભાસદો ની સુખાકારી માટે સંચાલક મંડળ સભાસદોને નિયમોની મર્યાદામાં રહીને મહત્તમ મદદ આપવા હંમેશા તત્પર હોય છે. તા. ૩૧/૦૩/૨૦૧૯ ના રોજ પૂરા થયેલ નાણાંકીય વર્ષમાં નીચેની વિગતે સભાસદોને વિવિધ મદદ પૂરી પાડવામાં આવી.

- તબીબી સહાય

સભાસદોને તેમની બિમારી સબબ સભાસદ કલ્યાણ ફંડમાંથી સભાસદોને થયેલ તબીબી ખર્ચના ૮૦% લેખે મહત્તમ રૂ. ૧૫,૦૦૦/- (અંકે રૂપિયા પંદર હજાર પૂરા) ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. આવી સહાય સને ૨૦૧૮-૧૯ ના વર્ષમાં ૫૮૭ સભાસદોને રૂ. ૬૪.૧૧ લાખ ચુકવાયેલ છે.

- સભાસદોના બાળકોને શૈક્ષણિક પ્રોત્સાહન

સભાસદોના તેજસ્વી બાળકોને શૈક્ષણિક પ્રોત્સાહન મળે તે માટે ઈનામી યોજના અમલમાં મુકેલ છે. આ ઈનામી યોજના



નીચે સને ૨૦૧૮-૧૯ ના વર્ષમાં સભાસદના ૧૦૦૫ બાળકોને ઈનામ આપવામાં આવેલ છે.

- અવસાન પામેલ સભાસદોના વારસદારોને મરણોત્તર સહાય

બેંકના સભાસદનું અવસાન થાય ત્યારે તેના વારસદારને રૂ. ૧૧,૦૦૦/- (અંકે રૂપિયા અગીયાર હજાર પૂરા) ની મરણોત્તર સહાય આપવામાં આવે છે. સને ૨૦૧૮-૧૯ ના વર્ષમાં આપણી બેંકના નીચે મુજબના ૪૫ (પિસ્તાલીસ) સભાસદોને બેંક તરફથી મરણોત્તર સહાય ચૂકવવામાં આવેલ છે. તેમજ અવસાન પામેલા સભાસદોના આત્માને મોક્ષગતિની પ્રાપ્તિ થાય તેવી બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, સભાસદો તથા સ્ટાફ વતી હું પ્રાર્થના કરું છું

- | | |
|-------------------------------------|------------------------------------|
| ૦૧. ભાનુબેન અમૃતલાલ બદ્રકિયા | ૨૪. પ્રવિણભાઈ ગીરધરલાલ ભારદીયા |
| ૦૨. ચંદ્રીકાબેન સુરેશભાઈ નંદા | ૨૫. રમેશચંદ્ર કાનજીભાઈ વસા |
| ૦૩. રમણીકલાલ શાંતીલાલ શાહ | ૨૬. જશવંતીબેન રાજેન્દ્રપ્રસાદ ભટ્ટ |
| ૦૪. શક્તિપ્રસાદ રતીલાલ વ્યાસ | ૨૭. દમયંતીબેન જેન્તીભાઈ લખીયર |
| ૦૫. જયંતીલાલ બાબુલાલ કટારમલ | ૨૮. ભાનુમતી રસીકલાલ શુક્લા |
| ૦૬. કાંતાબેન જયંતીલાલ અઘેરા | ૨૯. શુભકરણ જગન્નાથ વૈદ્ય |
| ૦૭. તેજાભાઈ મેઘજીભાઈ ટીંબડીયા | ૩૦. શાંતીલાલ મોતીચંદ હરીયા |
| ૦૮. પ્રહલાદભાઈ પ્રભુદાસ બુધ્ધ | ૩૧. મનસુખલાલ મોહનલાલ અડાલજા |
| ૦૯. ધર્મીષ્ઠાબેન નવનીતલાલ દવે | ૩૨. ઈન્દુમતીબેન જયંતીલાલ મહેતા |
| ૧૦. મનહરલાલ શાંતીલાલ ઝવેરી | ૩૩. સવીતાબેન રણછોડભાઈ નાખવા |
| ૧૧. વીરચંદ ભારમલ દોઢીયા | ૩૪. દામજીભાઈ રામજીભાઈ ગોહીલ |
| ૧૨. કેશવલાલ લખમશી શાહ | ૩૫. રમેશભાઈ મનસુખલાલ જોઈશર |
| ૧૩. નર્મદાબેન વલ્લભદાસ ચોટાઈ | ૩૬. સુરેશભાઈ પોપટલાલ મહેતા |
| ૧૪. નરોત્તમદાસ પોપટલાલ મહેતા | ૩૭. ભાનુમતીબેન કાંતીલાલ ઠાકર |
| ૧૫. કેતન સંપતલાલ શાહ | ૩૮. નટવરલાલ લક્ષ્મીદાસ ફલીયા |
| ૧૬. મીનાક્ષીબેન મહેન્દ્રભાઈ પાટડીયા | ૩૯. કાંતીલાલ ધીરજલાલ માલાણી |
| ૧૭. વિજયભાઈ જયંતીલાલ સોલાણી | ૪૦. ભરતકુમાર લીલાધર દોઢીયા |
| ૧૮. જશવંતરાય ઠાકરશી શેઠ | ૪૧. મોહનલાલ ગોકળદાસ જેઠવા |
| ૧૯. અભી નલીનભાઈ થડેસ્વર | ૪૨. શૈલેષ હીરાલાલ ભાનુશાળી |
| ૨૦. ભગવાનલાલ પોપટલાલ પૂંજાણી | ૪૩. અમૃતલાલ નરશી શાહ |
| ૨૧. પ્રહલાદરાય શ્રીક્રિષ્ન લઠ્ઠા | ૪૪. રંભાબેન અમૃતલાલ શાહ |
| ૨૨. હેમીબેન નાગજીભાઈ ત્રાડા | ૪૫. ભરત વેણીરામ રાવલ |
| ૨૩. ભગવાનજી ફુલચંદ શાહ | |

૧૫. સામાજિક ઉત્તરદાયિત્વ :

બેંક પોતાની સામાજિક જવાબદારી અદા કરવા માટે હમેશા તત્પર હોય છે. આ અંગે આર.બી.આઈ. ની ગાઈડલાઈન મુજબ ચોખ્ખા નફાના ૧% ની મર્યાદામાં વર્ષ દરમ્યાન અનુદાન આપી શકાય છે. આ અંગે જળ સંચય યોજના નીચે રૂ. પાંચ લાખ સહીત એકંદર રૂ. ૬.૯૩ લાખની આર્થિક સહાય સામાજિક સંસ્થાઓને અને ટ્રસ્ટોને આપવામાં આવેલ છે.

૧૬. આભાર દર્શન :

બેંકની પ્રગતિ અને સફળ સંચાલનમાં નોંધપાત્ર ફાળો આપવા બદલ બેંકના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી રમણિકલાલ કે. શાહ, વાઈસ ચેરમેન શ્રી નાથાલાલ વી. મુંગરા, જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર શ્રી હિતેશભાઈ જી. પરમાર તથા બોર્ડ ઓફ



ડાયરેક્ટર્સના તમામ સભ્યશ્રીઓ કે જેઓએ બેંકના તમામ વિકાસ કાર્યોમાં ઉંડો રસ દાખવી બેંકના વહીવટ અને નિતી વિષયક નિર્ણયો માટે તેમના સલાહ સુચનો દ્વારા યોગદાન આપી અમુલ્ય સહકાર આપેલ છે તે બદલ સૌનો અંતઃકરણ પુર્વક આભાર માનું છું.

બેંકના વિકાસ માટે બોર્ડના સભ્યોએ પોતાનો કિંમતી સમય ફાળવી કોઈપણ જાતની સીટીંગ ફી અગર ભથ્થા લીધા વગર ડાયરેક્ટર તરીકે બેંકના વિકાસમાં અમુલ્ય ફાળો આપેલ છે.

બેંકના પ્રારંભથી જ આજ દિવસ સુધી સેવાભાવી કાર્યકરો, વ્યાપાર ઉદ્યોગના અગ્રણીઓ તેમજ વિવિધ ક્ષેત્રોના વ્યવસાયલક્ષી અગ્રણીઓની સેવાઓ પ્રશંસનીય રહી છે. માનનીય જિલ્લા રજીસ્ટ્રાર શ્રી તથા બેંકનું સ્ટેચ્યુટરી ઓડીટ કરનાર હરિકિષ્ના ઘાડીયા એન્ડ કુ.ના ઓડીટરશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું.

બેંકના ચીફ જનરલ મેનેજર શ્રી આર.કે. પાઠ, જનરલ મેનેજર શ્રી ડી.ડી.સેજપાલ, ડે. જનરલ મેનેજર (ક્રેડીટ) શ્રી એ.આર. ઝવેરી, ડે. જનરલ મેનેજર (એડમીન) શ્રી આર.ડી. અઢીયા, શાખા મેનેજરશ્રીઓ, અધિકારીઓ તથા કર્મચારીગણે બેંકને પોતાની સંસ્થા ગણી ખંત ઉત્સાહ અને વફાદારી સાથે રોજ - બરોજની કામગીરી જવાબદારી પુર્વક અદા કરી ગ્રાહકોનો અતુટ વિશ્વાસ સંપાદન કરેલ છે. આગામી વર્ષોમાં પણ ઉત્તરોત્તર પ્રગતી સાધવા તેઓ કટીબદ્ધ રહે તેવો અનુરોધ કરું છું.

અંતમાં, બેંકની વિકાસ યાત્રામાં સહભાગી બનવા બદલ હું સર્વે ગ્રાહકો, શુભેચ્છકો, માહિતી પ્રસારણના તમામ માધ્યમોનો અને જામનગર શહેરના લોકોનો ખૂબ આભારી છું. આપ સર્વે તરફથી સતત ૪૧ વર્ષોથી બેંકને જે સહકાર મળેલ છે અને ધી નવાનગર કો-ઓપરેટીવ બેંકને પોતાની બેંક સમજી ને જામનગર શહેરના વિભિન્ન અંગોએ જે પ્રતિસાદ આપેલ છે તેને પરીણામે જ આજે આપણી બેંક જામનગરની અગ્રગણ્ય સહકારી બેંક બની શકી છે તે બદલ હું બેંક વતી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું આ સાથે આપણી બેંકની છેલ્લા પાંચ વર્ષની પ્રગતીની રૂપરેખા પણ નીચે કોષ્ટકમાં આપેલ છે.

બેંકની વિચારધારા હંમેશ માટે પ્રગતીશીલ અને પરિણામલક્ષી રહી છે. અમારો આશય જામનગરની જનતાને વધુમાં વધુ કાર્યક્ષમ, ઉત્કૃષ્ટ અને ગ્રાહકલક્ષી બેંકીંગ સેવાઓ પૂરી પાડવાનો છે. અમોને વિશ્વાસ છે કે અમારી આ વિકાસ યાત્રામાં આપ સર્વે સદા સહયોગી અને સહભાગી બની રહેશો.

આપનો વિશ્વાસુ
કિરણભાઈ આર. માધવાણી
ચેરમેન

પાંચ વર્ષની બેંકની પ્રગતિની રૂપરેખા (રકમ રૂપીયામાં)

વિગત	૨૦૧૪-૨૦૧૫	૨૦૧૫-૨૦૧૬	૨૦૧૬-૨૦૧૭	૨૦૧૭-૨૦૧૮	૨૦૧૮-૨૦૧૯
સભાસદ સંખ્યા	૬૮૯૦	૭૦૭૧	૭૩૨૪	૭૫૮૦	૭૮૪૭
ભરપાઈ શેર મુડી	૯,૨૩,૯૭,૦૦૦	૯,૮૯,૫૩,૦૦૦	૧૧,૯૭,૮૧,૦૦૦	૧૩,૭૧,૪૭,૦૦૦	૧૬,૦૫,૮૫,૦૦૦
રીઝર્વસ	૧,૦૨,૮૬,૯૯,૦૦૦	૧,૦૮,૧૮,૭૫,૦૦૦	૧,૧૩,૦૪,૯૪,૦૦૦	૧,૧૮,૯૬,૧૫,૦૦૦	૧,૨૫,૧૧,૮૬,૦૦૦
થાપણો	૪,૩૮,૫૮,૨૭,૦૦૦	૫,૧૧,૯૦,૫૩,૦૦૦	૬,૨૦,૩૬,૯૧,૦૦૦	૬,૨૮,૫૯,૯૮,૦૦૦	૬,૬૮,૯૭,૯૬,૦૦૦
ધિરાણો	૧,૮૫,૭૭,૮૯,૦૦૦	૨,૦૧,૯૦,૭૮,૦૦૦	૨,૩૦,૩૬,૪૭,૦૦૦	૨,૯૬,૫૭,૭૬,૦૦૦	૩,૬૨,૨૧,૪૯,૦૦૦
ચોખ્ખો નફો	૫,૬૭,૯૭,૦૦૦	૬,૩૩,૫૧,૦૦૦	૬,૩૧,૬૫,૦૦૦	૭,૫૩,૭૭,૦૦૦	૯,૯૦,૫૯,૦૦૦
કાર્યકારી ભંડોળ	૫,૬૨,૮૩,૯૫,૦૦૦	૬,૪૭,૬૫,૮૭,૦૦૦	૭,૫૭,૮૪,૫૩,૦૦૦	૭,૮૨,૧૭,૨૦,૦૦૦	૮,૩૬,૬૧,૨૩,૦૦૦
ઓડીટ વર્ગ	અ	અ	અ	અ	અ



Harikrishna Ghadia & Co.

Chartered Accountant

Auditor's Report

To,
The Members,
The Nawanagar Cooperative Bank Ltd.,
'Nawanagar Bank Bhavan', Hirji Mistry Road, Opp. Pranami School, Jamnagar – 361 004.

We are appointed as Statutory Auditors for your Bank by the Registrar, Co-Operative Societies, Gujarat State, vide order reference no. અખણ/૨૪૬૦/૪-૪/૩૭૫/૨૦૧૮ તા. ૧૯/૦૬/૨૦૧૮. We have conducted the audit on the basis of necessary details and information provided by the bank for our audit purpose and we submit our report as under:

Report on Financial Statements

1. We have audited the accompanying financial statement of Nawanagar Co-operative Bank Limited ('the Bank') as at 31st March 2019, which comprise the Balance Sheet as at 31st March 2019, and the Profit and Loss Account, and the Cash Flow Statement for the year then ended, and a summary of significant accounting policies and other explanatory information. The returns of 11 branches audited by us are incorporated in these financial statements.

Management's Responsibility for the financial statement

2. Management is responsible for the preparation of these financial statement that give a true and fair view of the financial position, financial performance and cash flow of the Bank in accordance with Banking Regulation Act 1949 (as applicable to co-operative societies), the guidelines issued by the Reserve Bank of India and the guidelines issued by the National Bank for Agriculture and Rural Development, The Registrar of Co-Operative Societies, Gujarat, The Gujarat Co-Operative Societies Act, 1961 and the Gujarat Co-Operative Societies Rules, 1965 (as applicable) and generally accepted accounting principles in India so far as applicable to the Bank. This responsibility includes design, implementation and maintenance of internal control relevant to the financial statement that are free from material misstatement, whether due to fraud or error.

Auditor's Responsibility

3. Our responsibility is to express an opinion on these financial statement based on our audit. We conducted our audit in accordance with standards on Auditing issued by the Institute of Chartered Accountants of India. Those standards require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether the financial statement are free from material misstatements.

4. An audit involves performing procedures to obtain audit evidence about the amounts and disclosures in the financial statements. The procedures selected depend on the auditor's judgment, including the assessment of the risks of material misstatements of financial statements, whether due to fraud or error. In making those risk assessments, the auditor considers internal control relevant to the Bank's preparation and fair presentation of the financial statements in order to design audit procedures that are appropriate in the circumstances, but not for the purpose of expressing an opinion on effectiveness of the entity's internal control. An audit also includes evaluating the appropriateness of the accounting policies used and the reasonableness of the accounting estimates made by management, as well as evaluating the overall presentation of the statements.



5. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion.

Opinion

6. In our opinion and to the best of our information and according to the explanations given to us, the financial statements together with the notes thereon give the information required by the Banking Regulation Act, 1949 (as applicable to Co-Operative Societies), the Gujarat Co-Operative Societies Act, 1961 and the guidelines issued by the National Bank for Agricultural and Rural Development (as applicable) and guidelines issued by Reserve Bank of India and Registrar of Co-Operative Societies in the manner so required and give a true and fair view in conformity with the accounting principles generally accepted in India:

- (a) In the case of the Balance Sheet, of state of affairs of the Bank as at 31st March 2019;
- (b) In the case of the Profit and Loss Account, of the profit / loss for the year ended on that date; and
- (c) In the case of the Cash Flow Statement, of the cash flow for the year ended on that date.

Report on other Legal & Regulatory Requirements

7. The Balance Sheet and the Profit and Loss Account have been drawn up in Form “A” and “B” respectively of the third Schedule to the Banking Regulation Act, 1949 and provisions of The Gujarat Co-Operative Societies Act, 1961 and Gujarat Co-Operative Societies Rules, 1965.

8. We report that:

- (a) We have obtained all the information and explanations, which to the best of our knowledge and belief were necessary for the purpose of our audit and have found to be satisfactory.
- (b) In our opinion, proper books of account as required by law have been kept by the Bank so far as it appears from our examination of those books and proper returns adequate for the purposes of our audit have been received from the branches/offices.
- (c) The transaction of the Bank which have come to our notice are within the powers of the Bank.
- (d) The Balance Sheet and Profit and Loss Account dealt with by this report, are in agreement with the books of account and the returns.
- (e) The accounting standards adopted by the Bank are consistent with those laid down by accounting principles generally in India so far as applicable to Banks.

9. We further report that for the year under audit, the Bank has been awarded “A” classification.

Place of signature: Rajkot

Date: 14.06.2019

For Harikrishna Ghadia & Co
Chartered Accountants
FRN No. 103534W

CA Kishan H Tanna
Partner
Membership Number: 126317
Panel No. 469



તા. ૩૧/૦૩/૨૦૧૯ ના રોજ પુરા થતાં વર્ષનું નફા-નુકશાન ખાતું

ખર્ચ	૩૧-૦૩-૨૦૧૮		૩૧-૦૩-૨૦૧૯	
	રૂ.	પૈસા	રૂ.	પૈસા
ચુકવેલ વ્યાજ થાપણ અને કરજ પર	૩૨,૨૧,૩૩,૨૭૩.૫૦		૩૩,૦૬,૭૬,૬૮૧.૬૯	
પગાર એલાઉન્સીઝ અને પ્રોવિડન્ટ ફંડ	૬,૩૦,૨૧,૮૩૦.૦૦		૬,૬૮,૬૬,૮૮૨.૦૦	
ડાયરેક્ટર્સ ફી		૦.૦૦		૦.૦૦
સ્ટેશનરી તથા પ્રિન્ટીંગ	૧૫,૬૮,૭૨૯.૩૬		૧૪,૬૩,૧૮૬.૦૧	
જાહેરાત ખર્ચ	૭,૮૮,૧૮૯.૦૦		૬,૪૩,૪૧૭.૦૦	
પોસ્ટેજ, ટેલીગ્રામ અને ટેલીફોન ખર્ચ	૭,૭૪,૫૨૬.૪૪		૮,૦૬,૯૮૯.૧૦	
વિમા પ્રીમીયમ	૭૫,૮૩,૦૭૨.૦૦		૯૧,૦૪,૬૩૯.૦૦	
ઓડીટ ફી	૬,૪૩,૬૧૪.૦૦		૮,૫૦,૩૩૨.૦૦	
ઈલેક્ટ્રીક ખર્ચ	૨૮,૨૮,૫૭૩.૦૦		૨૭,૫૧,૬૫૧.૦૦	
લવાજમ	૧,૫૬,૧૩૫.૦૦		૨,૧૨,૧૦૦.૦૦	
પરચુરણ ખર્ચ	૨૫,૨૦,૩૧૭.૫૪		૨૭,૯૧,૦૪૪.૨૭	
લીગલ એડવાઈઝર્સ / કન્સલ્ટન્ટ્સ ફી	૧,૬૩,૦૨૨.૦૦		૨,૦૦,૯૮૧.૦૦	
મકાન ભાડું અને વેરા	૪૧,૨૫,૮૭૬.૦૦		૪૫,૮૧,૯૮૭.૦૦	
મકાન મરામત ખર્ચ	૨,૪૬,૬૪૨.૦૦		૨,૩૭,૬૬૯.૦૦	
મુસાફરી ખર્ચ	૧,૫૩,૪૩૧.૦૦		૨,૯૨,૯૬૨.૦૦	
ઘસારા ખર્ચ - ફર્નિચર તથા મકાન ઉપર	૮૪,૬૭,૫૮૨.૯૭		૭૯,૦૫,૭૧૫.૦૦	
સ્ટાફ ગ્રુપ ગ્રેચ્યુઈટી પ્રીમીયમ	૨૨,૭૭,૯૯૮.૦૦		૩૫,૦૦,૦૦૦.૦૦	
કોમ્પ્યુટર ખર્ચ	૫,૨૬,૫૦૯.૭૩		૭,૪૮,૯૨૧.૯૦	
લીઝડ લાઈન ખર્ચ	૧૧,૧૨,૩૦૦.૦૦		૨૩,૩૪,૨૯૫.૦૦	
એસ.એમ.એસ. ખર્ચ	૧,૭૧,૧૩૦.૦૦		૯૦,૭૬૯.૦૦	
સોફ્ટવેર ખર્ચ	૫,૦૪,૭૫૪.૦૦		૩,૯૪,૦૩૫.૦૦	
લીગલ ખર્ચ	૬૨,૨૮૨.૦૦		૪,૦૨,૫૮૨.૦૦	
કન્વેન્સ ખર્ચ	૪,૭૫,૪૦૫.૪૭		૫,૩૨,૦૭૭.૦૦	
સરવાળો આગળના પાને લઈ ગયા	૪૨,૦૩,૦૫,૧૯૩.૦૧		૪૩,૭૪,૧૮,૯૧૫.૯૭	



તા. ૩૧/૦૩/૨૦૧૯ ના રોજ પુરા થતાં વર્ષનું નફા-નુકશાન ખાતું

આવક	૩૧-૦૩-૨૦૧૮ રૂ. પૈસા	૩૧-૦૩-૨૦૧૯ રૂ. પૈસા
વ્યાજ આવક ધિરાણ ઉપર	૨૪,૮૦,૯૭,૦૬૭.૫૪	૩૦,૧૭,૧૬,૨૦૯.૫૭
વ્યાજ આવક રોકાણો ઉપર	૩૧,૭૮,૧૬,૦૦૯.૪૦	૩૦,૯૩,૭૪,૨૫૭.૮૯
કમિશન	૯,૭૪,૯૯૩.૨૯	૪,૯૯,૨૯૮.૯૭
લોકર ભાડા ખાતે	૪૨,૩૪,૭૭૭.૦૦	૪૦,૨૫,૨૦૯.૦૦
પરચુરણ આવક	૧૭,૫૪,૫૯૩.૨૦	૨૧,૫૦,૩૪૨.૭૧
ઈન્સીડેન્ટલ ચાર્જ	૨૪,૦૩,૩૮૬.૭૩	૨૪,૯૩,૯૯૬.૫૨
શેર ટ્રાન્સફર ફી	૪૦,૯૩૦.૦૦	૨૫,૦૧૫.૦૦
ઈન્સપેક્શન ચાર્જ	૧૨,૮૦,૩૮૮.૮૫	૧૦,૩૫,૮૫૧.૮૫
ડીવીડન્ડ ઈન્કમ	૭૫૦.૦૦	૭૫૦.૦૦
લીમીટ પ્રો. ચાર્જ	૬૨,૧૨,૮૮૧.૭૨	૮૩,૮૮,૫૫૩.૫૯
ઈન્કમેટેક્સ તરફથી મળેલ વ્યાજ આવક	૦.૦૦	૮૬,૩૦૪.૦૦
જંગમ મિલકત વેચતા થયેલ નફો	૫૯,૩૩૩.૩૩	૧,૫૪,૬૪૨.૯૨
નોમીનલ મેમ્બર ફી	૫,૭૭૫.૦૦	૫,૭૫૦.૦૦
રેફરલ ફી આવક	૧૪,૪૨,૧૭૫.૧૭	૧૧,૦૨,૩૨૨.૩૨
સ્પે. એડહેસીવ સ્ટેમ્પ્સ વેચતા મળેલ કમીશન	૪,૪૦,૦૦૦.૦૦	૬,૧૦,૦૦૦.૦૦
ચેકબુક ઈસ્યુ ચાર્જ્સ	૧૧,૯૯,૭૭૫.૦૦	૧૨,૧૩,૨૬૯.૦૦
અગાઉના વર્ષમાં કરેલ વધારાની જોગવાઈઓ	૧,૦૮,૮૮૦.૦૦	૧૬,૪૩,૫૦૪.૦૦
અગાઉના વર્ષમાં દાવા કરેલ ધિરાણ ખાતામાં આવેલ વસુલાત	૧૬,૫૩૧.૭૪	૪,૯૩,૬૪૮.૪૩
પ્રધાનમંત્રી વિમા યોજના કમીશન	૬૯,૨૩૬.૦૦	૭૭,૬૨૧.૦૦
રૂપે ડેબીટ કાર્ડ કમીશન	૭,૫૭,૩૫૫.૯૧	૧૪,૮૯,૦૨૧.૫૦
અગાઉના વર્ષમાં કરેલ વધારાનું ઈન્કમેટેક્સ પ્રોવીઝન	૨૧,૬૨,૯૨૦.૦૦	૯,૫૮,૯૩૬.૦૦
એ.ટી.એમ. કાર્ડ રી-ઈસ્યુ ફી	૧૫,૦૬૮.૦૦	૧૦,૬૫૦.૦૦
જામીનગીરી વેચતા થયેલ નફો	૦.૦૦	૧૦,૦૫,૦૦૦.૦૦
સરવાળો આગળના પાને લઈ ગયા	૫૮,૯૦,૯૨,૮૨૭.૮૮	૬૩,૮૫,૬૦,૧૫૪.૨૭



તા. ૩૧/૦૩/૨૦૧૯ ના રોજ પુરા થતાં વર્ષનું નફા-નુકશાન ખાતું

ખર્ચ	૩૧-૦૩-૨૦૧૮		૩૧-૦૩-૨૦૧૯	
	રૂ.	પૈસા	રૂ.	પૈસા
પાછલો સરવાળો	૪૨,૦૩,૦૫,૧૯૩.૦૧		૪૩,૭૪,૧૮,૯૧૫.૯૭	
ઇલેક્ટ્રીક ફિટીંગ ખર્ચ	૪૪,૫૧૮.૦૦		૧,૨૧,૦૪૫.૦૦	
મીટીંગ ખર્ચ	૧,૧૯,૫૪૯.૦૦		૧૩,૦૪૬.૦૦	
સીક્યોરીટી સર્વિસ ચાર્જ	૧૭,૪૩,૪૦૩.૦૦		૧૮,૨૯,૧૯૬.૦૦	
બ્રાન્ચ ઓપનીંગ સેરેમની ખર્ચ	૧,૫૮,૫૦૩.૦૦		૦.૦૦	
સી.કે.વાય.સી એક્સેસ ફી	૧૦,૯૦૦.૦૦		૧૦,૯૦૦.૦૦	
ડીમેટ / એસજીએલ. ટ્રાન્ઝે ખર્ચ	૫,૬૦૬.૦૦		૨,૦૮૦.૦૦	
એન્યુઅલ જનરલ મીટીંગ ખર્ચ	૧,૪૮,૧૧૩.૦૦		૧,૫૧,૨૦૪.૦૦	
ઈકવી. મે. ખર્ચ	૧૨,૮૬,૦૯૧.૨૦		૧૦,૫૧,૫૪૮.૪૨	
એડવાઈઝરી ફી ગીલ્ટ / સીબીલ	૧,૬૮,૬૮૧.૦૦		૫,૨૭,૨૫૪.૦૦	
બેંક ચાર્જસ	૩,૨૦,૪૫૦.૩૬		૧૬,૫૦૦.૬૯	
પ્રોફેશનલ ટેક્સ	૨૦,૦૦૦.૦૦		૨૨,૬૦૩.૦૦	
કેશ પીક-અપ વાન ચાર્જસ	૪,૦૪,૫૫૦.૦૦		૪,૨૨,૯૨૦.૦૦	
બુક્સ એન્ડ પીરીયોડીક્લ્સ	૫,૫૬૦.૦૦		૧૨,૯૮૫.૦૦	
હાઉસકીર્પીંગ ખર્ચ	૨,૮૮,૬૪૦.૦૦		૨,૮૭,૭૬૦.૦૦	
એ.ટી.એમ. કાર્ડ મેનેજમેન્ટ ખર્ચ	૧૨,૩૬,૬૫૩.૦૦		૩૨,૦૫,૧૫૫.૦૦	
જી.એસ.ટી. પેઈડ	૬,૩૩,૯૮૭.૦૧		૨,૬૧,૯૧૯.૩૩	
રૂપે ડેબીટ ચાર્જસ	૬,૪૨,૮૪૨.૦૭		૧૧,૦૨,૩૬૨.૦૨	
જંગમ મિલકતો વેંચતા થયેલ નુકશાન	૪૬,૬૨૦.૧૫		૨૫,૮૩૭.૩૯	
જામીનગીરી ખરીદી પ્રીમીયમ	૭,૬૯,૩૦૯.૦૦		૩૬,૯૭,૭૧૯.૦૦	
સર્વિસ ટેક્સ	૫,૩૩,૬૮૫.૬૪		૦.૦૦	
મોટર કાર ફ્યુઅલ ખર્ચ	૮૫,૩૪૧.૦૦		૨૧,૨૨૦.૦૦	
લોસ ડ્યુ ટુ કેશ મીસએપ્રોપ્રીએશન	૪૩,૫૪,૯૮૬.૦૦		૦.૦૦	
પ્રોફેશનલ ફી પેઈડ ટુ આર્કીટેક્ટ	૦.૦૦		૧,૦૦,૦૦૦.૦૦	
ચુંટણી ખર્ચ	૦.૦૦		૧૬,૦૩૧.૦૦	
એપ્રન્ટીસ તાલીમ ભથ્થુ	૦.૦૦		૩,૬૩,૯૭૨.૦૦	
જોગવાઈ :				
પ્રોવિઝન ફોર બેડ એન્ડ ડાઉટકુલ ડેબ્ટ્સ એકાઉન્ટ	૧,૨૦,૦૦,૦૦૦.૦૦		૧,૪૫,૦૦,૦૦૦.૦૦	
પ્રોવિઝન ફોર ઈન્કમ ટેક્સ	૪,૩૫,૦૦,૦૦૦.૦૦		૫,૪૦,૦૦,૦૦૦.૦૦	
સ્ટાફ બોનસની જોગવાઈ	૮,૯૬૭.૦૦		૧૯,૦૬૭.૦૦	
પ્રોડક્ટીવીટી લીન્કડ ઈન્સેન્ટીવ	૧,૦૦,૦૦,૦૦૦.૦૦		૧,૦૦,૦૦,૦૦૦.૦૦	
શ્રી ઈન્વેસ્ટમેન્ટ ફલક્યુએશન રીઝર્વ	૫૦,૦૦,૦૦૦.૦૦		૦.૦૦	
નિયમિત કરજદારોને ચુકવવાપાત્ર વળતર જોગવાઈ	૪૫,૫૩,૦૦૦.૦૦		૫૨,૦૦,૦૦૦.૦૦	
સભાસદ ભેટની જોગવાઈ	૫૧,૦૦,૦૦૦.૦૦		૫૧,૦૦,૦૦૦.૦૦	
ડિફર્ડ ટેક્સ પ્રોવિઝન	૨,૨૦,૦૦૦.૦૦		૦.૦૦	
ચાલુ વર્ષનો ચોખ્ખો નફો	૭,૫૩,૭૭,૬૭૯.૪૪		૯,૯૦,૫૮,૯૧૩.૪૫	
કુલ સરવાળો	૫૮,૯૦,૯૨,૮૨૭.૮૮		૬૩,૮૫,૬૦,૧૫૪.૨૭	



તા. ૩૧/૦૩/૨૦૧૯ ના રોજ પુરા થતાં વર્ષનું નફા-નુકશાન ખાતું		
આવક	૩૧-૦૩-૨૦૧૮ રૂ. પૈસા	૩૧-૦૩-૨૦૧૯ રૂ. પૈસા
પાછલો સરવાળો	૫૮,૯૦,૯૨,૮૨૭.૮૮	૬૩,૮૫,૬૦,૧૫૪.૨૭
કુલ સરવાળો	૫૮,૯૦,૯૨,૮૨૭.૮૮	૬૩,૮૫,૬૦,૧૫૪.૨૭

અમારા આજ તારીખના સાથેના ઓડિટ રીપોર્ટ તેમજ હિસાબ અંગેની વિશેષ નોંધને આધીન.

સ્થળ : રાજકોટ
તારીખ : ૧૪-૦૬-૨૦૧૯

ફોર હરીક્રિષ્ના ઘાડીયા એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ
FRN :- 103534W

શ્રી કિરણભાઈ આર. માધવાણી
ચેરમેન

શ્રી નાથાલાલ વી. મુંગરા
વાઈસ ચેરમેન

શ્રી રમણિકલાલ કે. શાહ
મેનેજિંગ ડાયરેક્ટર

શ્રી હિતેષભાઈ જી. પરમાર
જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર

સહી/-
સી.એ. કિશન એચ. તપા
(પાર્ટનર)
મેમ્બરશીપ નં. ૧૨૬૩૧૭ પેનલ નં : ૪૬૯

ડાયરેક્ટર્સ

શ્રી ધીરજલાલ જે. કનખરા

શ્રી પરમાણંદભાઈ વી. ખટ્ટર

શ્રી સતિશચંદ્ર એમ. કુંડલીયા

શ્રી ચંદુલાલ આર. શાહ

શ્રી સુભાષચંદ્ર કે. શાહ

શ્રી વિજયકુમાર એમ. શેઠ

શ્રી નિલેશભાઈ એમ. ટોલીયા

શ્રી હસમુખભાઈ ઇ. હિંડોચા

શ્રી કિરીટભાઈ પી. મહેતા

શ્રી ભરતભાઈ આર. ઓઝા

શ્રીમતી પ્રિતીબેન એ. ખારેચા

શ્રીમતી શારદાબેન કે. વિજુંડા

શ્રી આર. કે. પાટ
ચીફ જનરલ મેનેજર

શ્રી ડી.ડી.સેજપાલ
જનરલ મેનેજર

શ્રી એ.આર. ઝવેરી
ડે. જનરલ મેનેજર (ક્રેડિટ)

શ્રી આર.ડી.અટીયા
ડે. જનરલ મેનેજર (એડમીન)



તા. ૩૧/૦૩/૨૦૧૯ ના રોજનું સરવૈયું

૩૧/૦૩/૨૦૧૮ રૂા. પૈસા	મૂડી અને જવાબદારીઓ	રૂા. પૈસા	૩૧/૦૩/૨૦૧૯ રૂા. પૈસા
<u>૨૦,૦૦,૦૦,૦૦૦.૦૦</u>	(૧) શેર ભંડોળ ૧. અધિકૃત શેર ભંડોળ દરેક રૂા. ૨૫/- ના એક એવા ૮૦,૦૦,૦૦૦ શેર્સ		<u>૨૦,૦૦,૦૦,૦૦૦.૦૦</u>
૧૩,૭૧,૪૭,૮૦૦.૦૦	૨. ભરપાઈ થયેલ શેર ભંડોળ દરેકના રૂા. ૨૫/- એવા ૬૪,૨૩,૪૦૨ શેર્સ પૈકી ૧) વ્યક્તિઓએ ધારણ કરેલ ૨) સહકારી મંડળીઓએ ધારણ કરેલ ૩) સરકારશ્રીએ ધારણ કરેલ	૧૬,૦૫,૮૫,૦૫૦.૦૦	૧૬,૦૫,૮૫,૦૫૦.૦૦
---	(૨) રીઝર્વ ફંડ અને અન્ય રીઝર્વ	---	
૩૩,૧૩,૦૬,૩૦૩.૮૬	૦૧. રીઝર્વ ફંડ	૩૫,૦૧,૨૧,૮૨૨.૪૦	
૨૩,૫૬,૮૩૫.૪૫	૦૨. ધર્માદા કલ્યાણ ફંડ	૨૮,૧૭,૬૩૫.૪૫	
૧૨,૭૧,૭૬,૩૧૨.૦૦	૦૩. બીલ્ડીંગ ફંડ	૧૩,૩૪,૧૭,૦૨૦.૦૦	
૧,૮૨,૮૫,૭૮૫.૭૫	૦૪. ડીવીડન્ડ ઈકવીલાઈઝેશન ફંડ	૨,૧૭,૮૨,૦૭૮.૭૫	
૧૫,૮૪,૮૩,૮૫૮.૬૮	૦૫. બેંક એન્ડ ડાઉટફુલ ડેટ રીઝર્વ	૧૬,૮૮,૦૦,૬૧૦.૬૮	
૩,૬૭,૮૮,૮૭૦.૮૦	૦૬. સહકારી પ્રચાર ફંડ	૪,૦૧,૭૦,૨૮૪.૮૦	
૭૮,૪૧,૦૫૩.૦૦	૦૭. સીલ્વર જ્યુબેલી ફંડ	૭૮,૪૧,૦૫૩.૦૦	
૧,૨૧,૮૮,૧૪૫.૪૦	૦૮. સભાસદ કલ્યાણ ફંડ	૧,૨૪,૫૭,૨૮૮.૪૦	
૧,૪૬,૪૮,૦૦૦.૬૧	૦૯. કન્ટ્રીજન્સી ફંડ	૧,૫૩,૮૬,૮૮૫.૬૧	
૧૪,૪૪,૬૭,૨૨૩.૩૫	૧૦. ઈન્વેસ્ટમેન્ટ ફલકચ્યુએશન રીઝર્વ	૧૪,૪૪,૬૭,૨૨૩.૩૫	
૧,૧૭,૮૫,૮૫૨.૨૫	૧૧. સીટી ડેવલોપમેન્ટ ફંડ	૧,૨૨,૮૫,૧૦૮.૨૫	
૪,૮૮,૫૦,૦૦૦.૦૦	૧૨. સ્ટાન્ડર્ડ એસેટ્સ માટે આકસ્મિક જોગવાઈ	૪,૮૮,૫૦,૦૦૦.૦૦	
૫,૦૪,૪૨,૧૧૩.૦૦	૧૩. સ્પેશ્યલ રીઝર્વ ફંડ	૫,૧૮,૩૮,૮૮૩.૦૦	
૬,૮૧,૨૧,૨૦૮.૫૫	૧૪. ઈન્વેસ્ટમેન્ટ ડેપ્રીસીએશન રીઝર્વ	૬,૮૧,૨૧,૨૦૮.૫૫	
૮,૬૬,૫૦,૦૦૦.૦૦	૧૫. બેંક એન્ડ ડાઉટફુલ ડેબ્ટ પ્રોવીઝન	૧૦,૧૧,૫૦,૦૦૦.૦૦	
૭૮,૮૧,૫૪૧.૦૦	૧૬. સભાસદ ભેટની જોગવાઈ	૮૧,૭૩,૪૨૧.૦૦	
૫,૪૪૭.૦૦	૧૭. સ્ટાફ વેલફેર ફંડ	૭૮,૪૪૮.૦૦	
<u>૫,૮૦,૧૪,૮૮૭.૦૦</u>	૧૮. ઈન્વેસ્ટમેન્ટ ડેપ્રી.રીઝર્વ (એમ.એમ.સી.બી.)	૫,૮૦,૧૪,૮૮૭.૦૦	
૧,૧૮,૯૬,૧૫,૭૫૭.૯૦			૧,૨૫,૧૧,૮૬,૦૭૯.૩૪
૧,૩૨,૬૭,૬૩,૫૫૭.૯૦	સરવાળો પાછળના પાને લઈ ગયા		૧,૪૧,૧૭,૭૧,૧૨૯.૩૪



તા. ૩૧/૦૩/૨૦૧૯ ના રોજનું સરવૈયું			
૩૧/૦૩/૨૦૧૮ રૂ. પૈસા	મિલ્કત અને લેણાં	૩૧. પૈસા	૩૧/૦૩/૨૦૧૯ રૂ. પૈસા
૧૫,૬૪,૩૦,૧૮૬.૫૮	(૧) રોકડ તથા બેંકોમાં બેલેન્સ હાથ ઉપર સિલક, રીઝર્વ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા/સ્ટેટ/સેન્ટ્રલ કો.ઓ.બેંકમાં		૨૪,૧૫,૮૦,૧૬૬.૦૮
૫૪,૪૭,૨૧,૪૫૮.૫૧	(૨) બીજી બેંકોમાં બેલેન્સ		
૦.૦૦	૧. ચાલુ ખાતામાં	૩૩,૮૮,૦૦,૨૮૧.૬૯	
૩૨,૪૧,૧૪,૯૯૭.૦૦	૨. સેવિંગ્સ ખાતામાં	૦.૦૦	
૮૬,૮૮,૩૬,૪૫૫.૫૧	૩. ફીક્સ ડીપોઝીટો	૪૨,૮૩,૧૪,૯૯૭.૦૦	૭૬,૭૧,૧૫,૨૭૮.૬૯
૦.૦૦	(૩) ટૂંકી મુદતની કોલ ડીપોઝીટ બેંકોમાં:		૦.૦૦
	(૪) રોકાણો :		
૩,૫૫,૧૧,૯૭,૨૮૬.૦૦	૧. સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્નમેન્ટ સીકયોરીટીઝ	૩,૪૨,૮૮,૪૧,૦૪૭.૦૦	
૦.૦૦	૨. બીજી ટ્રસ્ટી સીકયોરીટીઝમાં	૦.૦૦	
૫,૦૫૦.૦૦	૩. સહકારી બેંકોના શેરોમાં	૫,૦૫૦.૦૦	
૨,૩૨,૯૦,૦૦૦.૦૦	૪. બીજા રોકાણો	૦.૦૦	
૩,૫૭,૪૪,૯૨,૩૩૬.૦૦	(૫) પ્રિન્સીપાલ/સબસીડીયરી સ્ટેટ પાર્ટનરશીપ ફંડમાંથી રોકાણો		૩,૪૨,૮૮,૪૬,૦૯૭.૦૦
૦.૦૦	(૬) ધિરાણો		૦.૦૦
૧,૫૯,૬૧,૦૧,૪૪૨.૧૮	૧. ટૂંકી મુદતની લોન, કેશ કેડીટ, ઓવરડ્રાફ્ટ અને વટાવેલા બીલો જે પૈકી	૨,૦૮,૫૦,૮૯,૪૪૨.૫૬	
---	(૧) સરકારી જામીનગીરી સામે	---	
	(૨) બીજી વાસ્તવિક જામીનગીરી સામે	૨,૦૮,૫૦,૮૯,૪૪૨.૫૬	
	જે પૈકી વ્યક્તિઓ પાસે લેણું	૨,૦૮,૫૦,૮૯,૪૪૨.૫૬	
	ધિરાણ પૈકી મુદત વીતેલ બાકી	૧,૬૦,૮૫,૯૮૬.૩૧	
	ધિરાણ પૈકી ડુબત અને શકમંદ લેણુ	૭૭,૨૩,૪૨૦.૬૧	
૪,૫૯,૯૭,૫૮,૯૭૮.૦૯	સરવાળો પાછળના પાને લઈ ગયા		૪,૪૩,૭૫,૪૧,૫૪૧.૭૭



તા. ૩૧/૦૩/૨૦૧૯ ના રોજનું સરવૈયું

૩૧/૦૩/૨૦૧૯ રૂા. પૈસા	મૂડી અને જવાબદારીઓ	રૂા. પૈસા	૩૧/૦૩/૨૦૧૯ રૂા. પૈસા
૧,૩૨,૬૭,૬૩,૫૫૭.૯૦	પાછલો સરવાળો		૧,૪૧,૧૭,૭૧,૧૨૯.૩૪
૩,૪૫,૩૩,૮૬,૭૫૩.૧૧	(૩) થાપણો અને અન્ય ખાતાઓ :		
	:૧: ફિક્સ ડિપોઝીટ :	૩,૭૧,૫૦,૩૮,૧૨૩.૮૮	
	૧. વ્યક્તિઓ ૩,૬૮,૪૫,૭૦,૨૪૦.૮૮		
	૨. મધ્યસ્થ બેંકો ૦.૦૦		
	૩. અન્ય મંડળીઓ ૩,૦૪,૬૮,૮૮૩.૦૦		
૨,૦૬,૮૭,૦૨,૫૦૨.૦૭	:૨: સેવિંગ ડિપોઝીટ :	૨,૧૧,૫૮,૦૮,૭૮૬.૪૫	
	૧. વ્યક્તિઓ ૨,૧૧,૫૦,૧૮,૧૭૬.૮૩		
	૨. મધ્યસ્થ બેંકો ૦.૦૦		
	૩. અન્ય મંડળીઓ ૮,૮૦,૬૧૮.૫૨		
૭૬,૨૮,૮૮,૧૧૬.૮૪	:૩: કરન્ટ ડિપોઝીટ :	૮૫,૮૮,૪૭,૮૮૭.૫૮	
	૧. વ્યક્તિઓ ૮૫,૨૩,૮૨,૭૧૨.૨૩		
	૨. મધ્યસ્થ બેંકો ૦.૦૦		
	૩. અન્ય મંડળીઓ ૬૪,૬૫,૧૮૫.૩૬		
૬,૨૮,૫૯,૯૮,૩૭૨.૧૨	(૪) કરજ		૬,૬૮,૯૭,૯૫,૮૧૭.૯૨
૦.૦૦	:૧: રીઝર્વ બેંક, સ્ટેટ/સેન્ટ્રલ કો-ઓપ.બેંકોમાંથી		૦.૦૦
	:અ: ટુંકી મુદતની લોન, કેશ કેડીટ અને ઓવરડ્રાફ્ટ પૈકી		
	૧) સરકારી જામીનગીરી સામે		
	૨) અન્ય વાસ્તવીક જામીનગીરી સામે		
	:બ: મધ્યમ મુદતની લોન		
	:ક: લાંબી મુદતની લોન		
૦.૦૦	:૨: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય બેંકોમાંથી		૦.૦૦
	:અ: ટુંકી મુદતની લોન, કેશ કેડીટ અને ઓવરડ્રાફ્ટ પૈકી		
	૧) સરકારી જામીનગીરી સામે		
૦.૦૦	૨) અન્ય વાસ્તવીક જામીનગીરી સામે		૦.૦૦
૭,૬૧,૨૭,૬૧,૯૩૦.૦૨	સરવાળો પાછળના પાને લઈ ગયા		૮,૧૦,૧૫,૬૬,૯૪૭.૨૬



તા. ૩૧/૦૩/૨૦૧૯ ના રોજનું સરવૈયું

૩૧/૦૩/૨૦૧૮ રૂ. પૈસા	મિલ્કત અને લેણાં	રૂ. પૈસા	૩૧/૦૩/૨૦૧૯ રૂ. પૈસા
૪,૫૯,૯૭,૫૮,૯૭૮.૦૯	પાછલો સરવાળો		૪,૪૩,૭૫,૪૧,૫૪૧.૭૭
૮૦,૬૭,૮૭,૬૧૨.૬૮	૨. મધ્યમ મુદતની લોન જે પૈકી (૧) સરકારી જામીનગીરી સામે (૨) બીજી વાસ્તવીક જામીનગીરી સામે ૯૮,૫૧,૫૩,૭૬૬.૪૨ જે પૈકી વ્યક્તિઓ પાસે લેણું ૯૮,૫૧,૫૩,૭૬૬.૪૨ ધિરાણ પૈકી મુદત વીતેલ બાકી ૨૮,૨૭,૬૫૮.૨૨ ધિરાણ પૈકી ડુબત અને શકમંદ લેણું ૬૦,૬૨,૩૪૬.૦૦	૯૮,૫૧,૫૩,૭૬૬.૪૨	---
૫૬,૨૮,૮૭,૩૨૬.૫૩	૩. લાંબી મુદતની લોન જે પૈકી (૧) સરકારી જામીનગીરી સામે (૨) બીજી વાસ્તવીક જામીનગીરી સામે ૫૫,૧૯,૦૫,૬૨૮.૭૪ જે પૈકી વ્યક્તિઓ પાસે લેણું ૫૫,૧૯,૦૫,૬૨૮.૭૪ ધિરાણ પૈકી મુદત વીતેલ બાકી ૧૧,૩૨,૦૩૮.૨૮ ધિરાણ પૈકી ડુબત અને શકમંદ લેણું ૫૪,૮૨,૮૬૨.૯૦	૫૫,૧૯,૦૫,૬૨૮.૭૪	---
૨,૯૬,૫૭,૭૬,૩૮૧.૪૦	કુલ ધિરાણ		૩,૬૨,૨૧,૪૮,૮૩૭.૭૨
૫,૩૭,૪૦,૦૨૭.૦૦	(બ) મળવાપાત્ર વ્યાજ (રોકાણો ઉપર)		૫,૯૫,૬૭,૮૦૨.૦૦
૨,૫૨,૦૪૭.૦૦	(૮) બીલ્સ રીસીવેબલ સામે બાજુ બતાવ્યા મુજબ		
૩૬,૨૧,૬૭૫.૦૦	૧. (અ) ઈનવર્ડ બીલ્સ રીસીવેબલ (બ) આઉટવર્ડ બીલ્સ રીસીવેબલ	૨,૫૧,૧૨૪.૦૦ ૫૧,૪૨,૩૯૩.૦૦	
૩૮,૭૩,૭૨૨.૦૦			૫૩,૯૩,૫૧૭.૦૦
૪,૨૪,૮૬,૧૦૬.૦૦	૨. ઈન્ટરેસ્ટ રીસીવેબલ (એન.પી.એ. ખાતાઓ)		૩,૮૮,૮૭,૨૪૫.૦૦
૬,૧૭,૦૬૫.૦૦	૩. અનકલેઈમ્ડ મેમ્બર ગીફ્ટ		૪,૭૦,૫૮૬.૦૦
	(૯) જામીનગીરી કર કપાત તથા એડવાન્સ ટેક્સ		
૩૦,૨૪,૬૮૭.૦૦	(૧) ટીડીએસ રીસીવેબલ	૪૪,૦૧,૫૮૪.૦૦	
૭,૪૦,૮૮,૩૫૫.૦૦	(૨) એડવાન્સ ઈન્કમ ટેક્સ	૧૨,૪૦,૮૮,૩૫૫.૦૦	
૭,૭૧,૧૪,૦૪૨.૦૦			૧૨,૮૪,૯૦,૬૩૯.૦૦
૭,૭૯,૭૫,૮૬૫.૯૩	(૧૦) સ્થાયર મિલ્કત (ઘસારા બાદ)		૭,૫૩,૮૦,૬૩૪.૯૩
૩,૨૫,૪૯,૦૬૨.૫૨	(૧૧) ફર્નિચર / ફીક્ચર્સ (ઘસારા બાદ)		૨,૮૫,૮૫,૯૪૧.૬૦
૭,૮૫,૩૮,૯૧,૨૪૯.૯૪	સરવાળો પાછળના પાને લઈ ગયા		૮,૩૯,૬૪,૬૭,૩૪૫.૦૨



તા. ૩૧/૦૩/૨૦૧૯ ના રોજનું સરવેયું

૩૧/૦૩/૨૦૧૮ રૂા. પૈસા	મૂકી અને જવાબદારીઓ	રૂા. પૈસા	૩૧/૦૩/૨૦૧૯ રૂા. પૈસા
૭,૬૧,૨૭,૬૧,૯૩૦.૦૨	પાછલો સરવાળો		૮,૧૦,૧૫,૬૬,૯૪૭.૨૬
૨,૫૨,૦૪૭.૦૦	(૫) બીલ્સ ફોર કલેક્શન સામી બાજુ બતાવ્યા પ્રમાણે	૨,૫૧,૧૨૪.૦૦	
૩૬,૨૧,૬૭૫.૦૦	:૧: (અ) ઈન્વર્ડ બીલ્સ કલેક્શન	૫૧,૪૨,૩૯૩.૦૦	
૩૮,૭૩,૭૨૨.૦૦	(બ) આઉટવર્ડ બીલ્સ કલેક્શન		૫૩,૯૩,૫૧૭.૦૦
૪,૨૪,૮૬,૧૦૬.૦૦	:૨: ઓવરડયુ ઈન્ટરેસ્ટ રીઝર્વ (એન.પી.એ.ખાતા)	૩,૮૮,૮૭,૨૪૫.૦૦	૩,૮૮,૮૭,૨૪૫.૦૦
૬,૧૭,૦૬૫.૦૦	:૩: અનકલેઈમ્ડ મેમ્બર ગીફ્ટ	૪,૭૦,૫૮૬.૦૦	૪,૭૦,૫૮૬.૦૦
---	(૬) બાન્ય એડજેસ્ટમેન્ટ	---	---
૫,૦૧,૧૮૦.૧૪	(૭) ઓવરડયુ ઈન્ટરેસ્ટ રીઝર્વ	૪,૫૮,૧૩૬.૧૪	૪,૫૮,૧૩૬.૧૪
૦.૦૦	(૮) ચુકવવાપાત્ર વ્યાજ :	૦.૦૦	૦.૦૦
૧૮,૪૨,૧૧૮.૦૦	(૯) બીજી જવાબદારીઓ :		
૪,૪૯,૩૯,૪૪૩.૨૩	૧. અન કલેઈમ્ડ ડિવીડન્ડ	૨૩,૯૪,૩૮૩.૦૦	
૩૪,૧૪,૮૪૫.૧૯	૨. ભરવાપાત્ર બીલો	૨,૧૭,૪૫,૭૧૭.૪૪	
૭,૪૮,૮૦,૦૦૦.૦૦	૩. બેડ એન્ડ ડાઉટફુલ ડેબ્ટ રીટર્ન ઓફ	૨૯,૨૧,૧૯૬.૭૬	
૪૩,૫૪,૯૮૬.૦૦	૪. ઈન્કમટેક્સ સંબંધી જોગવાઈઓ	૧૨,૮૮,૮૦,૦૦૦.૦૦	
૩૬,૪૭,૫૭૫.૮૨	૫. પ્રોવીઝન ફોર મીસ એપ્રોપ્રીએશન ઓફ કેશ	૪૩,૫૪,૯૮૬.૦૦	
૧૩,૩૦,૭૮,૯૬૮.૨૪	૬. અન્ય	૪૨,૭૧,૩૯૧.૨૪	૧૬,૪૫,૬૭,૬૭૪.૪૪
૭,૫૩,૭૭,૬૭૯.૪૪	(૧૦) નફા નુકશાન ખાતું		
	ગઈસાલનો નફો ૭,૫૩,૭૭,૬૭૯.૪૪		
	બાદ : ફાળવણી ૭,૫૩,૭૭,૬૭૯.૪૪		
	ઉમેરો ચાલુ સાલનો નફો		૯,૯૦,૫૮,૯૧૩.૪૫
	(૧૧) કન્ટ્રીજન્ટ જવાબદારીઓ		
	(૧) ગેરેન્ટી ઈસ્યુ		
	આ આકસ્મિક જવાબદારી સંબંધિત ખાતેદારોની		
	સ્થાવર/જંગમ મિલકતો દ્વારા સુરક્ષીત છે.		
	ગઈસાલ ૩૫,૭૭,૦૦૦.૦૦		
	ચાલુસાલ ૩૬,૭૭,૦૦૦.૦૦		
	(૨) અનકલેઈમ ડીપોઝીટ (રેફ ફંડ)	૧,૭૯,૧૯,૩૬૩.૮૬	
૭,૮૬,૮૬,૯૬,૬૫૦.૮૪	કુલ સરવાળો...		૮,૪૧,૦૪,૦૪,૦૧૯.૨૯



તા. ૩૧/૦૩/૨૦૧૯ ના રોજનું સરવૈયું

૩૧/૦૩/૨૦૧૮ રૂા. પૈસા	મિલકત અને લેણાં	રૂા. પૈસા	૩૧/૦૩/૨૦૧૯ રૂા. પૈસા
૭,૮૫,૩૮,૯૧,૨૪૯.૯૪	પાછલો સરવાળો		૮,૩૯,૬૪,૬૭,૩૪૫.૦૨
૬૫,૮૮૬.૦૦	(૧૨) અન્ય અસ્કચામતો	૬૫,૮૮૬.૦૦	
૧૧,૮૦૦.૦૦	૦૧. ટેલીફોન ડીપોઝીટ	૧૦,૦૦૦.૦૦	
૧,૬૦૦.૦૦	૦૨. એડવાન્સ પેમેન્ટ	૧,૬૦૦.૦૦	
૧૩,૩૭,૩૫૭.૦૦	૦૩. ગેસ ડીપોઝીટ	૧૧,૧૦,૮૫૩.૦૦	
૪૯,૮૩,૨૯૫.૦૦	૦૪. સ્ટેશનરી સ્ટોક	૪૨,૯૦,૨૫૦.૦૦	
૬,૦૬,૧૪૭.૦૦	૦૫. એડહેસીવ સ્ટેમ્પસ ઓન હેન્ડ	૬,૦૬,૧૪૭.૦૦	
૧,૦૦,૦૦૦.૦૦	૦૬. જી.ઈ.બી. મીટર ડીપોઝીટ	૧,૦૦,૦૦૦.૦૦	
૯,૯૮,૩૫૦.૦૦	૦૭. બ્રાંચ બિલ્ડીંગ મેઈન્ટેનન્સ ડીપોઝીટ	૩,૬૪,૨૨૨.૦૦	
૨,૧૫૦.૦૦	૦૮. અગાઉથી ચુકવેલ ખર્ચા	૨,૧૫૦.૦૦	
૪૮,૦૧૦.૦૦	૦૯. વોટર કનેક્શન ડીપોઝીટ	૨,૦૫૦.૦૦	
૦.૦૦	૧૦. એડહેસીવ સ્ટેમ્પસ	૪૫,૯૬૩.૦૦	
૦.૦૦	૧૧. ભારત બીલ (બીબીપીએસ) યુરોનેટ ડીપોઝીટ	૫,૦૦,૦૦૦.૦૦	
૩,૪૦૦.૦૦	૧૨. ગુજરાત ગેસ ડીપોઝીટ	૨,૨૦૦.૦૦	
૨,૧૩,૫૦૦.૦૦	૧૩. લોકર સ્ટેમ્પ	૧,૯૫,૦૦૦.૦૦	
૬,૪૧,૭૦૩.૦૦	૧૪. ફેસ્ટીવલ એડવાન્સ	૩,૦૦,૦૭૩.૦૦	
૨,૩૫,૦૯૧.૦૧	૧૫. સસ્પેન્શ લો ચાર્જસ	૨,૨૧,૨૫૩.૮૬	
૪૩,૫૪,૯૮૬.૦૦	૧૬. જી.એસ.ટી રીસીવેબલ	૪૩,૫૪,૯૮૬.૦૦	
૧૧,૦૦,૦૦૦.૦૦	૧૭. મીસએપ્રોપ્રીએટેડ કેશ એકાઉન્ટ	૧૭,૦૦,૦૦૦.૦૦	
૫૪,૯૮૫.૯૯	૧૮. પી.જી.વી.સી.એલ.બીલ કલેક્શન ડીપોઝીટ	૪૦,૪૮૦.૪૧	
	૧૯. મળવાપાત્ર અન-કલેઈમ્ડ ડીપોઝીટ આર.બી.આઈ.		
૧,૪૭,૫૮,૨૬૦.૯૦		૨૩,૫૬૦.૦૦	૧,૩૯,૧૩,૧૧૪.૨૭
૪૭,૧૪૦.૦૦	(૧૩) રેસીડ્યુઅલ પ્રિમીયમ ઓન પરચેઈઝ ઓફ સીક્યોરીટીઝ		૨૩,૫૬૦.૦૦
૭,૮૬,૮૬,૯૬,૬૫૦.૮૪	કુલ સરવાળો		૮,૪૧,૦૪,૦૪,૦૧૯.૨૯

અમારા આજ તારીખના સાથેના ઓડિટ રીપોર્ટ તેમજ હિસાબ અંગેની વિશેષ નોંધને આદીન.

સ્થળ : રાજકોટ
તારીખ : ૧૪-૦૬-૨૦૧૯

ફોર હરીક્રિષ્ના ધાડીયા એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ

FRN :- 103534W
સહી/-

શ્રી કિરણભાઈ આર. માધવાણી
ચેરમેન

શ્રી નાથાલાલ વી. મુંગરા
વાઈસ ચેરમેન

શ્રી રમણિકલાલ કે. શાહ
મેનેજિંગ ડાયરેક્ટર

શ્રી હિતેષભાઈ જી. પરમાર
જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર

ડાયરેક્ટર્સ

શ્રી ધીરજલાલ જે. કનખરા

શ્રી પરમાણંદભાઈ વી. ખટ્ટર

શ્રી ચંદુલાલ આર. શાહ

શ્રી સુભાષચંદ્ર કે. શાહ

શ્રી નિલેશભાઈ એમ. ટોલીયા

શ્રી હસમુખભાઈ ઈ. હિંડોયા

શ્રી ભરતભાઈ આર. ઓઝા

શ્રીમતી પ્રિતીબેન એ. ખારેયા

શ્રી આર. કે. પાટ

શ્રી ડી.ડી.સેજપાલ

શ્રી એ.આર. ઝવેરી

ચીફ જનરલ મેનેજર

જનરલ મેનેજર

ડે. જનરલ મેનેજર (ક્રેડીટ)

શ્રી આર.ડી.અટીયા

ડે. જનરલ મેનેજર (એડમીન)

મેમ્બરશીપ નં. ૧૨૬૩૧૭ પેનલ નં : ૪૬૯

શ્રી સતિશચંદ્ર એમ. કુંડલીયા

શ્રી વિજયકુમાર એમ. શેઠ

શ્રી કિરીટભાઈ પી. મહેતા

શ્રીમતી શારદાબેન કે. વિજુંડા

**The Nawanagar Co-Operative Bank Ltd., Jamnagar****Background, Significant Accounting Policies and Notes attached to and forming part of the Balance Sheet as at 31st March, 2019 and Profit and Loss Account for the year ended 31st March, 2019****A. Background:**

The Nawanagar Co-Operative Bank Ltd. is a co-operative society engaged in the banking business and was incorporated in 1980. Presently the bank provides banking facility through its 11 branches and 1 extension counter in the Jamnagar district. The bank provides various financial products which cater to the needs of its customers.

B. Significant Accounting Policies:**1. Accounting Convention:**

The accompanying standalone financial statements have been prepared and presented under the historical cost convention. The said statements were prepared on accrual basis of accounting, except postage, local authority dues, AMC charges, Utility Bills, consultant fees etc. which are charged to profit and loss account on payment basis. The said statements were prepared on a going concern basis. The said statements were prepared in compliance with

- the generally accepted accounting principles in India issued by ICAI,
- statutory requirements prescribed under the Banking Regulation Act, 1949,
- statutory requirements prescribed the Gujarat Co-Operative Act, 1961,
- circulars and guidelines issued by the Reserve Bank of India ('RBI') from time to time, and
- in accordance with the current practices prevailing amongst the Co-Operative Banks in India.

2. Use of Estimates

In preparation of the said financial Statements,

- In compliance with generally accepted accounting principles issued by ICAI,
- statutory requirements prescribed under the Banking Regulation Act, 1949,
- statutory requirements prescribed the Gujarat Co-Operative Act, 1961 and
- circulars and guidelines issued by the Reserve Bank of India,

The management of the bank requires to make estimates and assumptions that affect the reported amounts of assets and liabilities, revenues and expenses and disclosure of contingent liabilities at the date of financial statements. Actual results could differ from those estimates. Management believes that the estimates used in the preparation of the financial statement are prudent, proper and reasonable. Any revision to the accounting estimates are recognized prospectively.

3. Investments**3.1 Categorization of Investments:**

In accordance with the guidelines issued by RBI, the Bank classifies its investment portfolio into three categories viz. "Held to Maturity", "Available for Sale" and "Held for Trading".



In respect of Securities included in any of the above three categories where interest/principle is in arrear for more than 180 days, income is not recognized as per prudential norms.

3.2 Classification of Investments:

For the purpose of disclosure in Balance Sheet investments have been classified as per requirement of Reserve Bank of India under the following heads:

Government Securities (Central & State),

Other approved securities,

Share of other Co-Operative Institutions

Bonds of PSUs and

Other Investments.

3.3 Valuation of Investments:

(i) Held to maturity:

Investments in HTM category are valued at acquisition cost unless it is more than the face value. In case where acquisition cost is more than face value, the premium (if any) paid on the investments under category is shown under “Other Assets” and is amortized over the period remaining to maturity.

(ii) Held for Trading & Available for Sale:

Investments of all scripts except PSU Bonds, under the category of Available for Sale and Held for Trading are valued scrip-wise at book value or market value whichever is lower. PSU Bonds under category of Available for Sale and Held for Trading are valued scrip-wise at acquisition cost. Depreciation/appreciation is aggregated for each classification. Net depreciation, if any, is provided for while net appreciation, if any, is ignored. Net Depreciation for the year under these categories is charged to Profit and Loss Account.

(iii) Shares of co-operative institution and financial corporations are valued at cost unless there is a diminution in the value thereof in which case the diminution is fully provided for.

(iv) Market value of the Government securities under available for sale is determined in terms of yield to maturity (YTM) method indicated by fixed income money market & derivatives association of India (FIMMDA).

(v) Broken period interest in respect of the Government securities purchased is treated as an item of expenditure under the Profit and Loss account.

4. Advances

4.1 All advances are classified as Standard, Sub-Standard, Doubtful and Loss Assets in accordance with guidelines issued by RBI. Provisions are made in accordance with the prudential norms prescribed by Reserve bank of India.

4.2 The overdue interest in respect of non-performing advances is provided separately under Overdue Interest Reserve as per directives issued by RBI.

4.3 As per policy and practice adopted by the bank, partial recoveries in NPAs are reduced from the principal



loan amount.

5. Fixed Assets and Depreciation :

- 5.1** Premises and other fixed Assets have been accounted for at historical cost less Depreciation.
- 5.2** Fixed Assets except computers are depreciated on Written down value method at the rate considered appropriate by the management. Computers are depreciated on Straight Line method @ 33.33% as directed by RBI.
- 5.3** Depreciation on Fixed Assets purchased during the year is charged for the entire year if asset is purchased and retained for 180 days or more. Otherwise it is charged at 50% of the normal rate. No depreciation is charged on assets sold during the year.
- 5.4** Fixed assets which have been fully depreciated but are still in use, are carried in the books at Rs. 1/-, however there are other assets which are in existence as per assets register, despite that value of assets was reduced to Zero. The bank is advised to physically verify such assets and to frame proper policy in the matter.

Accounting Standard 6 and 10 issued by the Institute of Chartered Accountants of India relating to Accounting for Fixed Assets and depreciation requires for disclosure of gross and net values of assets and accumulated depreciation thereon. However, as per the format applicable to Co-operative Banks, the above disclosure are not made in the accounts and to that extent, the disclosure norms of the above stated Accounting standards as referred above have not been followed. However, the same has no impact on the result of the Bank.

6. Revenue Recognition

Interest and other income are recognized on accrual basis except the following, which are recognized on realization basis.

- 6.1** Interest and other income on Non Performing Advances as per RBI Norms.
- 6.2** Locker Rent
- 6.3** Commission Income
- 6.4** Income from distribution of Insurance products
- 6.5** Interest on Income Tax Refunds

7. Employee Benefits

The Bank has taken group gratuity with the Life Insurance Corporation of India for payment of retirement gratuity as well as leave encashment under the scheme of this corporation. The annual contribution to gratuity Fund and leave encashment are paid on yearly premium basis. The bank has funded on retirement gratuity and leave encashment to Life Insurance Corporation of India amounting to Rs. 35,00,000/- (Previous Year: Rs. 22,77,998/-) and Rs. 16,55,217/- (Previous Year: Rs. 5,33,586/-) respectively.

The Bank's contribution to provident fund is accounted for on the basis of contribution to the Employees' Provident Fund Scheme Account set up by the Government on accrual basis.

8. Segment Reporting

The Bank is organized into two main business segments mainly:

(I) Treasury



(ii) other Banking Operations

However, the above disclosure are not made in accounts and to that extent, the disclosure norms of the Accounting Standards as referred above have not been followed. However, the same has no impact on the results of the bank.

9. Operating Leases

Lease rent obligations in respect of assets taken on operating lease are charged to Profit and Loss Account on straight line basis over the lease term. Initial direct costs are charged to profit and loss account. The bank has paid lease rental of Rs. 43,17,795/- (Previous Year: 39,02,617/-).

10. Income Tax

Provision for current Tax is made on the basis of estimated taxable income for the year.

Deferred tax is recognized, subject to consideration of prudence, on timing difference, representing the difference between taxable income and accounting income that originated in one period and is capable of reversal in one or more subsequent periods. Deferred tax assets and liabilities are measured using tax rates and tax laws that have been enacted or subsequently enacted by the Balance Sheet Date.

11. Impairment of Assets

At each balance sheet date, bank assesses whether there is any indication that any asset of the bank may be impaired. If any such indication exists, the carrying value of such assets is reduced to its estimated recoverable amount and the amount of such impairment loss is charged to profit and loss account. If, at the Balance sheet date there is an indication that a previously assessed impairment loss no longer exists, the recoverable amount is reassesses and the asset is reflected at the recoverable amount subject to maximum of depreciated historical cost. However, at the year end, there is no indication regarding impairment of any of bank's assets, hence no provision for impairment loss is made.

12. Accounting for Provisions, Contingent Liabilities

The bank recognizes provisions only when it has a present obligation as a result of past events and the existence of which will be confirmed only by the occurrence or non-occurrence of one or more uncertain future events not wholly within the control of the Bank.

Contingent Assets are not recognized since this may result in the recognition of income that will never be realized.

13. Contingencies and material event occurring after balance sheet date:

Material events occurring after the date of balance sheet are recognized. Contingencies, which can be reasonably ascertained, are provided for, if in the opinion of the management of the bank, there is a possibility that the future outcome may be materially detrimental to the bank.

14. Related party Disclosures – Key Managerial Personnel

14.1 Revenue transaction with Key Managerial Personnel

Sr. No.	Name of Key Managerial Personnel	Rs. (In Lakhs)	Remarks
1	Mr. R. K. Padh (Chief General Manager & CEO)	6.99	Salary paid during the F.Y. 2018-19

**14.2 Loans granted to Directors & their relatives**

Sr. No.	Loans granted to Directors & their relatives	Outstanding Balance as on 31-03-2019 Rs. (In Lakhs)	Remarks
1	Loan Granted to Directors	7.01	Loan / OD against Fixed Deposits
2	Loans Granted to Director's Relative	5.02	Loan / OD against Fixed Deposits
3	Loans Granted to Director's Relative	41.25	Loan against LIC Policy

The Accounting Policies which are material or critical in determining the results of operations for the year or financial position as set out in the financial statements are in consistence with those adopted in the financial statements for the previous year. The financial statements are prepared on accrual basis except as stated otherwise in the financial statements.

C. OTHER NOTES FORMING PARTS OF ACCOUNTS FOR THE YEAR 2018-19**1. Provision for Contingencies**

Net Profit arrived after "Provision and Contingencies" which includes.

- Bad Debt Reserve
- Provision for Income tax
- Staff Bonus payable
- Provision for productivity Linked Incentive
- Provision for rebate to punctual borrowers
- Provision for Members Gift

2. Investments include fixed deposits pledged as follows:

Rs. 6,00,00,000/- (Previous Year: Rs. 5,70,00,000/-) pledged with IDBI Bank Ltd, Jamnagar against overdraft limit sanctioned to the bank. The outstanding against the said facility as on 31.03.2019 was Rs. NIL (Previous Year: Rs. NIL).

3. Contingent Liabilities includes:

- Guarantee issued by the bank on behalf of customers is Rs. 36,77,000/- (Previous Year: Rs. 35,77,000/-).
- Unclaimed deposits (Amount transferred to the Depositor Education and Awareness Fund Scheme, 2014) for the year ended on 31.03.2019 is Rs. 1,79,19,363.86 (Previous year Rs. 1,49,38,898.52).

D. Other Disclosures:**1. Investments:**

- The Pattern of securities held under the "Held to Maturity" (At book value) as on 31st March, 2019 are as under:

	Rs. In Lakhs	
	31.03.2019	31.03.2018
Central Government Security	5,912.79	5,912.79



T-Bills	0.00	1940.80
State Development Loan	986.02	0.00
Total	6898.81	7,853.59
% of total time and demand deposits	10.31%	12.49%

1.2 The pattern of other securities held under the “Available for Sale” (At book value) as on 31st March, 2019 are as under:

	Rs. In Lakhs	
	31.03.2019	31.03.2018
Central Government Security	22,987.08	23,255.87
State Government Security	4,402.51	4,402.51
PSU Bonds	0.00	232.90
Total	27,389.59	27,891.28

2. Reserves:

2.1 Investments Depreciation Reserve: Rs. In Lakhs

	31.03.2019	31.03.2018
Investments Depreciation Reserve	1,281.36	1,281.36

2.2 The Investment Fluctuation Reserve of Rs. 1444.67 Lacs which worked out to 5.27% of Investments held under “Available for Sale” category.

3. Other Working:

		Rs. In Lakhs	
Sr. No.	Particulars	31-03-2019	31-03-2018
1	Capital to Risk Assets Ratio (CRAR)	22.72%	26.55%
2	Movement in CRAR:		
	Total Capital Funds	7,161.39	6,709.61
	Risk Weighted Assets	31,526.53	26,523.59
3	Investments:		
	Book Value	34,288.41	33,804.07
	Face Value	35,095.80	34,570.80
	Market Value	35,911.28	35,085.28
4	Advances Against:		
	Real Estate and Construction	87.85	112.43
	Housing	5,019.02	5,078.84
5	Advances against Shares and Debentures	0.00	0.00
6	Advances to Directors and their relatives, companies/ firms in which they are interested :		



	Fund Based	53.28	27.52
	Non Fund Based	0.00	0.00
7	Average Cost of Deposits	5.17%	5.35%
8	NPAs		
	Gross NPAs	192.68	256.51
	Net NPAs	0.00	0.00
9	Movement in NPAs		
	Gross NPAs		
	Opening Balance	256.51	250.64
	Add: Additions during the year	197.98	12.44
	Less: Reduction during the year	261.81	6.57
	Closing Balance	192.68	256.51
	Net NPAs		
	Opening Balance	0.00	0.00
	Add: Addition during the year	0.00	0.00
	Less: Reduction during the year	0.00	0.00
	Closing Balance	0.00	0.00
10	Profitability:		
	Interest income as a percentage of working funds	7.34%	7.24%
	Non-Interest income as a percentage of working funds	0.29%	0.30%
	Operating Profit as a percentage of working funds	2.25%	1.99%
	Return on average assets	8.26%	8.06%
	Business (Deposits + Advances) per Employee	818.41	740.14
	Operating Profit Per Employee	14.91	12.46
11	Provision made towards:		
	NPAs	2709.51	2,451.44
	Investment Depreciation Reserve – Investments	691.21	691.21
	Investment Depreciation Reserve – MNCB	590.15	590.15
	Standard Assets	499.50	499.50
12	Movements in Provisions:		
	Towards NPAs		
	Opening Balance	2,451.44	2,161.69
	Add: Addition during the year	258.07	289.74
	Less: Reduction during the year	0.00	0.00
	Closing Balance	2,709.51	2,451.43
	Towards Depreciation on Investments		
	Opening Balance	1,281.36	1,281.36



	Add: Addition during the year	0.00	0.00
	Less: Reduction during the year	0.00	0.00
	Closing Balance	1,281.36	1,281.36
	Towards Standard Assets		
	Opening Balance	499.50	499.50
	Add: Addition during the year	0.00	0.00
	Less: Reduction during the year	0.00	0.00
	Closing Balance	499.50	499.50
13	DEAF :		
	Opening Balance	149.39	145.19
	Add. : Amt. Transferred to DEAF during the year	36.42	20.13
	Less : Amt. Reimbursed by DEAF during the year	6.62	15.93
	Closing Balance	179.19	149.39
14	Foreign Currency Assets and Liabilities	N.A.	N.A.
15	Payment of DICGC Insurance Premium	68.68	71.02
	Arrears in payment of DICGC Insurance Premium	0.00	0.00
16	Penalty imposed by RBI	0.00	0.00

4. Details of Issuer composition of Non – SLR investments and non – performing Non – SLR Investment

4.1 Issuer Composition of Non – SLR Investments

Rs. In Lakhs

No.	Particulars of Issuers	Amount at Book value	Extent of 'Below Investment Grade Securities'	Extent of 'Unrated Securities'	Extent of 'Unlisted Securities'
(1)	(2)	(3)	(4)	(5)	(6)
1	PSUs	NIL	NIL	NIL	NIL
2	Fis	NIL	NIL	NIL	NIL
3	Public Sector Banks	NIL	NIL	NIL	NIL
4	Mutual Funds	NIL	NIL	NIL	NIL
5	Others (Shares of Central & State Co – Op. Banks)	0.05	NIL	NIL	0.05
6	Provision held towards Depreciation	NIL	NIL	NIL	NIL

**4.2 Non – Performing Non – SLR Investment**

Particulars	31-03-2019	31-03-2018
Opening Balance	NIL	NIL
Addition During the year	NIL	NIL
Reduction during the year	NIL	NIL
Closing Balance	NIL	NIL

5. Details of advances sacrificed:

Particular	Housing Loan		SME Debt Restructuring		Others	
	No. of Accounts	Amount Sacrificed	No. of Accounts	Amount Sacrificed	No. of Accounts	Amount Sacrificed
Standard Advances restructured	NIL					
Sub Standard restructured Advances						
Doubtful Advances restructured						
Total						

Place of signature: Rajkot
Date: 14.06.2019

For Harikrishna Ghadia & Co
Chartered Accountants
FRN No. 103534W

CA Kishan H Tanna
Partner
Membership Number: 126317
Panel No. 469



પરિશિષ્ટ - ૧
રોકાણોની વિગતો તા. ૩૧/૦૩/૨૦૧૯

નોન એસ.એલ.આર. રોકાણો

મુદતી થાપણો	રકમ	રૂ.
૧. માઘવપુરા મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લી.	૫,૮૮,૧૪,૯૯૭.૦૦	
૨. આઈ.ડી.બી.આઈ. બેંક	૭,૦૦,૦૦,૦૦૦.૦૦	
૩. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક	૨૦,૦૦,૦૦,૦૦૦.૦૦	
૪. યુનીયન બેંક ઓફ ઈન્ડિયા	૯,૯૫,૦૦,૦૦૦.૦૦	
	<u>૪૨,૮૩,૧૪,૯૯૭.૦૦</u>	
અન્ય રોકાણો		
૫. જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંક લી.	૫૦.૦૦	
૬. ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંક લી.	૫,૦૦૦.૦૦	
	<u>૫,૦૫૦.૦૦</u>	
કુલ નોન એસ.એલ.આર. રોકાણો (અ)	૪૨,૮૩,૨૦,૦૪૭.૦૦	

એસ.એલ.આર. રોકાણો

સ્ટેટ ડેવલપમેન્ટ લોન સીક્યોરીટીઝ		
૧. આંધ્રપ્રદેશ સ્ટેટ ડેવલપમેન્ટ લોન	૧૩,૮૧,૭૭,૪૬૪.૦૦	
૨. મહારાષ્ટ્ર સ્ટેટ ડેવલપમેન્ટ લોન	૧૬,૪૭,૮૦,૦૦૦.૦૦	
૩. ગુજરાત સ્ટેટ ડેવલપમેન્ટ લોન	૧૯,૮૬,૮૭,૭૦૦.૦૦	
૪. તામીલનાડુ સ્ટેટ ડેવલપમેન્ટ લોન	૩,૬૨,૦૮,૮૦૦.૦૦	
	<u>૫૩,૮૮,૫૩,૯૬૪.૦૦</u>	
ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા સિક્યોરીટીઝ		
૫. ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા લોન	૨,૮૮,૯૯,૮૭,૦૮૩.૦૦	
	<u>૨,૮૮,૯૯,૮૭,૦૮૩.૦૦</u>	
કુલ એસ.એલ.આર. રોકાણો (બ)	૩,૪૨,૮૮,૪૧,૦૪૭.૦૦	
કુલ રોકાણો (અ) + (બ)	૩,૮૫,૭૧,૬૧,૦૯૪.૦૦	



બેંકની રજીસ્ટર્ડ ઓફીસ

" નવાનગર બેંક ભવન ", હિરજી મીસ્ત્રી રોડ, પ્રણામી સ્કુલ સામે , જામનગર

ફોન નંબર:- ૦૨૮૮-૨૫૬૩૯૮૪-૮૫-૮૮-૮૯-૯૦-૯૩, ફેક્સ નંબર:- ૦૨૮૮-૨૫૬૩૯૮૯

E-mail : ho@nawanagarbank.co.in, Website : www.nawanagarbank.co.in

શ્રી આર. કે. પાઠ શ્રી ડી.ડી.સેજપાલ શ્રી એ.આર. ઝવેરી શ્રી આર.ડી.અઢીયા
ચીફ જનરલ મેનેજર જનરલ મેનેજર ડે. જનરલ મેનેજર(ક્રેડીટ) ડે. જનરલ મેનેજર (એડમીન)

દિ.પ્લોટ શાખા	ઉદ્યોગનગર શાખા	હોસ્પિટલ રોડ શાખા	શરૂ સેકશન શાખા
શાખા મેનેજર શ્રી રાજેશ શાહ ૧૭-બી, દિ.પ્લોટ જામનગર ૩૬૧૦૦૫ ફોન નંબર: ૨૫૫૨૮૫૭, ૨૬૭૬૯૦૯, ૨૫૪૦૪૯૩, ૨૫૪૦૧૬૭	શાખા મેનેજર શ્રી અજય શેઠ " નવાનગર બેંક ભવન" હીરજી મીસ્ત્રી રોડ, પ્રણામી સ્કુલ સામે જામનગર ૩૬૧૦૦૪ ફોન નંબર: ૨૫૬૩૯૮૯-૪૦ ૨૫૬૮૫૮૫	શાખા મેનેજર શ્રી પારસ કુંડલીયા ૧૦૧-૧૦૨-૧૦૩ ક્રોસ વે ઈન્દીરા માર્ગ કોર્નર, હોસ્પિટલ રોડ, અંબર ચોકડી, જામનગર ૩૬૧૦૦૮ ફોન નંબર: ૨૬૭૧૫૪૩, ૨૬૭૧૫૧૯, ૨૫૧૦૮૬૨	શાખા મેનેજર શ્રી નિતીન મહેતા "તૃપ્તી", પારસ સોસાયટી પંચવટી, શરૂ સેકશન રોડ જામનગર ૩૬૧૦૦૮ ફોન નંબર: ૨૬૬૨૫૧૮, ૨૬૬૨૪૩૫, ૨૫૧૦૮૬૧
રણજીત રોડ	ગુલાબનગર	દરેડ	ખંભાળીયા રોડ
શાખા મેનેજર શ્રી રૂપેન શાહ "સીમન્ધર કોમ્પ્લેક્સ" રણજીત રોડ, રતનબાઈ મસ્જીદની સામે, જામનગર ૩૬૧૦૦૧ ફોન નંબર:- ૨૫૪૧૨૩૬-૩૩ ૨૫૧૦૮૬૩	શાખા મેનેજર શ્રી ધર્મશ શેઠ રાજકોટ હાઈવે, ગુલાબનગર જામનગર ૩૬૧૦૦૪ ફોન નંબર:- ૨૫૭૧૯૨૧ ૨૫૭૧૫૬૮	શાખા મેનેજર શ્રી નિલેશ વોરા જી.આઈ.ડી.સી.ફેઝ-૨, દરેડ, જામનગર ૩૬૧૦૦૫ ફોન નંબર:- ૨૭૩૦૫૪૧, ૨૭૩૦૫૪૨	શાખા મેનેજર શ્રી હરીશ શાહ મયુર કોમ્પ્લેક્સ, શોપ નં.૭-૮ ખોડીયાર કોલોની જામનગર ૩૬૧૦૦૬ ફોન નંબર:- ૨૭૧૨૧૩૪-૩૬
રણજીત સાગર રોડ	ગોકુલનગર	પંચેશ્વર ટાવર રોડ	હરિયા એક્ષ. કાઉન્ટર
શાખા મેનેજર શ્રી ભરત છાપીયા શોપ નં. ૯-૧૦-૧૧-૧૨ આઉન્ડ ફ્લોર, રાહુલ કોર્પોરેટ ગ્રીન સીટી, રણજીત સાગર રોડ જામનગર ૩૬૧૦૦૫ ફોન નંબર: ૨૭૩૧૩૩૦-૩૧	શાખા મેનેજર શ્રી મેહુલ દોશી પ્લોટ નંબર:-૧૩૪/બી, સર્વ નંબર:-૧૩૯૮ ૨ડાર રોડ, ગોકુલનગર જામનગર ૩૬૧૦૦૧ ફોન નંબર:-૨૫૬૧૫૩૩	શાખા મેનેજર શ્રી રાજીવ શેઠ શોપ નંબર:- ૫૩-૫૪-૫૫ ઈન્દ્રપ્રસ્થ, પંચેશ્વર ટાવર રોડ જામનગર ૩૬૧૦૦૧ ફોન નંબર: ૨૫૫૧૧૦૪-૦૫	આસી. મેનેજર શ્રી દિલીપ ખેતીયા હરિયા સ્કુલ કમ્પાઉન્ડ, ઈન્દીરા માર્ગ, જામનગર ૩૬૧૦૦૪ ફોન નંબર: ૨૫૬૪૪૩૮